

# **PANTH** Infinity INTENDED TO INSPIRE

7<sup>th</sup> September, 2021

To,	To,
BSE Limited	The Calcutta Stock Exchange Limited
The Department of Corporate Services	The Compliance Department
P. J. Towers, Dalal street,	7, Lyons Range, Dalhousie,
Mumbai-400 001,	Murgighata, B B D Bagh,
Maharashtra.	Kolkata-700001, West Bengal
BSE Code: 539143	CSE Code: 30010

# Sub.: Newspaper publication of Notice of 28th Annual General Meeting, E-voting and Book **Closure:**

Dear Sir/Madam,

Pursuant to the provisions of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are pleased to enclose herewith a Newspaper copy of Notice of 28<sup>th</sup> Annual General Meeting, E-voting and Book Closure published in "Financial Express" (English) and "Gujarat Guardian" (Gujarati) newspaper dated 7th September, 2021.

Kindly take the same on your record and oblige.

Thanking you.

Yours faithfully, For PANTH INFINITY LIMITED

JINAY KORADIYA Chairman & Managing Director DIN: 03362317

Encl.: As above



PANTH INFINITY LIMITED | CIN: L45201GJ1993PLC114416

Registered Office : 101, Siddh Chambers, Taratiya Hanuman Street, Gurjar Faliya, Haripura, Surat-395003, Gujarat.

🚺 +91-70439 99011 🖾 info@panthinfinity.com

www.panthinfinity.com

ලා

# **FINANCIAL EXPRESS**

#### Unline E – Auction Sale Of Asset kotak KOTAK MAHINDRA BANK LIMITED statt Mainimiting Basi

Registered office: 27 BKC, C-27, G-Block, Bandra Kurla Complex, Bandra {E}, Mumbal, Maharashira, Pin Code-400 051, Branch Office: G1, Twin Tower, Sahara Darwaja, Ring RoadSural - 395 002.

### Sale Notice For Sale of Immovable Properties

E-Auction sale notice for sale of immovable assets under The Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 under rule 8(5) Read with rule 8 (6) of The Security Interest (Enforcement) Rule, 2002.

Notice is hereby given to the public in general and in particular to the borrower (s) and guarantor (s) that the below described immovable property mortgaged/charged to the secured creditor, the physical possession of which has been taken by the authorised officer of Kotak Mahindra Bank Ltd. on 28.07.2021, pursuant to assignment of debt in its favour by BHFL, will be sold on "As is where is", "As is what is", and "Whatever There Is" on 12.10.20221 between 12:00 pm to 01:00 pm with unlimited extension of 5 minutes, for recovery of Rs. 25,48,189/- as of 01.09.2021 along with future Applicable Interest Till Realization, under the Loan Account No. 5J8RHT70255630, 5J8RHB67230727, due to the Kotak Mahindra Bank Ltd., Secured Creditor From Mr. Dhanjibhai Raghubhai Gamara & Mrs. Vaniben Dhnjibhai Gamara. The reserve price will be Rs. 12, 00,000 /- (Rupees Twelve Lakhs Only) and The Earnest Money Deposit will Rs. 1,20,000 /- (Rupees One Lakhs Twenty Thousand Only) & Last Date of Submission of EMD With KYC is 11.10.2021up to 7:00 p.m. (IST.)

Property Description: West Side of Plot No. 29/P, Wadhwan Rev.Sr.No.2007/P, S.Nagar, T.P.S.No.2, O.P.No.18, f.P.21/P, Magmani Ambika Society, B/H New S.P. School, 80 Road Area, at Surendra Nagar Taluka Wadhwan District Surendra Nagar - 363001, North - Plot No.22, South -Road, East-PlotNo.29/P, UnitNo.2, West-Lagu PlotNo.28.

The borrower's attention is invited to the provisions of sub section 8 of section 13, of the act, in respect of the time available, to redeem the secured asset. Public in general and borrowers in particular please take notice that if in case auction scheduled herein fails for any reason whatsoever then secured creditor may enforce security interest by way of sale through private treaty. In case of any clarification/requirement regarding assets under sale, bidder may Contact Mr. Rajender Dahiya (+91 8448264515), Mr. Kishore Arora (+91 7227953457), Mr. Brijesh Parmar (+91 9727739158) & Mr. Ravinder Godara (+91 9983999074). For detailed terms and conditions of the sale, please refer to the link https://www.kotak.com/en/bank-auctions.htm provided in Kotak Mahindra Bank website i.e. www.kotak.com and/oron https://bankauctions.in.

Place: Surendra Nagar, Date: 04.09.2021 Authorized Officer: Kotak Mahindra Bank Limited



0

Registered office: 27 BKC, C-27, C-Block, Bandra Kurla Complex, Bandra (E), Mumbai, Maharashira, Pin Code-400 051, Branch Office: G1, Twin Tower, Sahara Darwaja, Ring RoadSurat - 395 002.

### Sale Notice For Sale of Immovable Properties

E-Auction sale notice for sale of immovable assets under The Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 under Rule 8(5) Read with rule 8 (6) of The Security Interest (Enforcement) Rule, 2002.

Notice is hereby given to the public in general and in particular to the borrower (s) and guarantor (s) that the below described immovable property mortgaged/charged to the secured creditor, the physical possession of which has been taken by the authorised officer of Kotak Mahindra Bank لtd، on 09.07.2021, pursuant to assignment of debt in its favour by BHFL, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 12.10.2021 between 12:00 pm to 01:00 pm with unlimited extension of 5 minutes, for recovery of Rs.12,60,857/- as of 01.09.2021 along with future applicable interest till realization, under the Loan Account No.11783183, due to the Kotak Mahindra Bank Ltd., Secured Creditor From Mr. Dharmeshbhai Thakorbhai Amin & Mrs. Geetaben Thakorbhai Amin. The reserve price will be Rs. 35, 00,000 /-(Rupees Thirty Five Lakhs Only) and The Earnest Money Deposit will be Rs. 3,50,000 /- (Rupees Three Lakhs Fifty Thousand Only) & Last Date of Submission of EMD with KYC is 11-10-2021 up to 7:00 p.m. (IST.)

Property Description: All that piece & parcel of immovable- property premises of Plot No. 43 Admeasuring North-South widh 14 fts x east-west lengh 45 fts i.e 630 sq vps, i.e 58.52 mtrs, 'Narsinh Nagar', B/H Modi Hospital, Kadodara Road Developed upon na land situated in State Gujarat, District: Surat, Sub-district & Taluka: Palsana, Moje: Gam Kadodara Bearing Revenue Survey No. 87 Block No 68. Property Bounded As: North: Plot No. 42, South: Plot No. 44, East : Block No. 72, West: Open Road

The borrower's attention is invited to the provisions of sub Section 8 of Section 13, of the Act, in respect of the time available, to redeem the secured asset. Public in general and borrowers in particular please take notice that if in case auction scheduled herein fails for any reason whatsoever then secured creditor may enforce security interest by way of sale through private reaty. In case of any clarification/requirement regarding assets under sale, bidder may Contact Mr. Ŕajender Dahiýa (+91 8448264515), Mr. Kishore Arora (+91 7227953457), Mr. Brijesh Parmar (+91 9727739158) & Mr. Ravinder Godara (+91 9983999074). For detailed terms and conditions of the sale, please refer to the link https://www.kotak.com/en/bank-auctions.html provided in kotak mahindra bank website i.e. www.kotak.com\_and/oron https://bankauctions.in\_ Place: Surat, Date: 04.09.2021 Authorized Officer: Kotak Mahindra Bank Limited



METROPOLITAN STOCK EXCHANGE OF INDIA LTD. Building A, Unit 205A, 2nd Floor, Piramal Agastya Corporate Park, L.B.S Road, Kurla West, Mumbai - 400 070. CIN - U65999MH2008PLC185856

PUBLIC NOTICE

Notice is hereby given that M/s Shah Investors Home Ltd. The member of Metropolitan Stock Exchange of India Ltd. ("Exchange") having registered office at P04-01E, Tower- A, World Trade Center, Block 51, Road 5E, Zone 5, Gyan Marg, Gift City, Gandhinagar -382355, Gujarat and SEBI Registration No. INZ000167335 have applied for surrender of their Trading Membership in Currency Derivatives, Equity Cash and Equity Derivatives Segments.

Any client/ constituent/member/investor having any claim /dispute /grievance with/against M/s Shah Investors Home Ltd, arising out of trades executed in Currency Derivatives, Equity Cash and Equity Derivatives Segments & Investor Grievance Department of the Exchange at the Registered Office address indicated above, within 60 days from the date of this notification; enclosing therewith all supporting documents. No such claims / dispute / grievances filed beyond the said period will be entertained by the Exchange. The complaints filed against the above trading member will be dealt with in accordance with the Rules, Bye-laws and Regulations of the Exchange/Metropolitan Clearing Corporation of India Ltd.


The complaint form can be downloaded from www.msei.in>Investors> ComplaintFormat or maybe obtained from the Exchange office at Mumbai and also at the Regional Offices.

For Metropolitan Stock Exchange of India Ltd.

Sd/-

Authorised Signatory

Place: Mumbai, Date: 07/09/2021



Website : http://gsfc.gujarat.gov.in E-mail: sec-cell-gsfc@gujarat.gov.in

## NOTICE OF 61<sup>57</sup> ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE

Notice is hereby given that the 61" Annual General Meeting (AGM) of the Corporation will be held on Thursday, the 30" September, 2021 at 1.00 p.m. IST through Video Conferencing (VC)/Other Audio Visual Means (OAVM) to transact the business as set out in the Notice of AGM which is being circulated for convening of AGM.

In accordance with the circulars issued by Securities and Exchange Board of India (SEBI) dated May 12, 2020 and January 15, 2021, the Corporation has sent the Notice of the AGM along with the Annual Report 2020-21 on 2" September, 2021 through electronic mode only to those members whose e-mail addresses are registered with the Corporation or Registrar & Share Transfer Agent (RTA) and Depositories as on Friday, the 26" March, 2021. The requirement of sending physical copies of the Notice of the AGM has been dispensed with.

Annual Report of the Corporation, inter alia, containing the Notice of the 61" AGM and other details is available on the websites of the Corporation at www.gsfc.gujarat.gov.in, BSE Ltd at www.bseindia.com and Central Depository Services Ltd (CDSL) at www.evotingindia.com.

Members holding shares either in physical mode or in dematerialized mode as on Friday, the 26" March, 2021, being the cut-off date, may cast their vote electronically on the businesses as set forth in the Notice of the AGM through electronic voting system of CDSL. All members of the Corporation are informed that:

The businesses as set forth in the Notice of the AGM will be transacted

# **GOPALA POLYPLAST LIMITED**

(CIN:- L25200GJ1984PLC050560)

Registered Office: - Plot No. 485, Santej Vadsar Road, Santej, Tal. Kalol, Dist. Gandhinagar Gujarat - 382721 Phone : (079) 27561000 Email : info@champalalgroup.com

# NOTICE FOR REVISION IN BOOK CLOSURE DATE

Notice is hereby given that, in continuation to our publication dated September 04,2021, in the matter of 37" Annual General Meeting of the company scheduled to be held on September 27,2021, there is change in Book Closure date which shall be read as under-

The Register of Members and the Share Transfer Books of the Company will be closed from Friday, September 17, 2021 to Monday, September 27, 2021. (Both days inclusive) for the purpose of AGM, instead of Monday, September 13, 2021.

Save for the above, all other information contained in the original notice will remains unchanged.

	By order of the Board of Directors		
	For Gopala Polyplast Limited		
	Khushboo Surana		
Date : September 04, 2021 Place : Ahmedabad	CS & Compliance Officer		
	Membership no- FCS8679		



## $\odot$ kotak

Registered office: 27 BKC, C-27, G-Block, Bandra Kurla Complex, Bandra (E), Mumbai, Maharashtra, Pin Code 400 051, Branch Office: G1, Twin Tower, Sahara Darwaja, Ring RoadSurat - 395 002.

## Sale Notice For Sale of Immovable Properties

E-Auction sale notice for sale of immovable assets under The Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 under rule 8(5) Read with rule 8 (6) of The Security Interest (Enforcement) Rule, 2002.

Notice is hereby given to the public in general and in particular to the borrower(s) and guarantor (s) that the below described immovable property mortgaged/charged to the secured creditor, the physical possession of which has been taken by the authorised officer of Kotak Mahindra Bank Ltd. on 26.07.2021, pursuant to assignment of debt in its favour by BHFL, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 12.10.2021 between 12:00 pm to 01:00 pm with unlimited extension of 5 minutes, for recovery of Rs.20,48,228/- as of 01.09.2021 along with future Applicable Interest Till Realization, under the Loan Account No. 428ZLT83183369 428ZCN87800708, 428ZCT84888784 due to the Kotak Mahindra Bank Ltd., Secured Credito From Mr. Bhupatbhai Parshotambhai Vasani & Mr. Jaysukhbhai Parshotambhai Vasani Property No. 1 -The reserve price will be Rs. 6,00,000/- and The Earnest Money Deposit will Rs.60,000/-, Property No. 2 - The reserve price will be Rs. 6, 00,000/- and The Earnest Money Deposit will Rs.60, 000/- & Last Date of Submission of EMD with KYC is 11.10.2021 up to 7:00 p.m. (IST.)

Property Description: Property No.1:- All that piece and parcel of Flat No 302 3rd Floor building No. -G, Shiv Residency Umra Olpad Surat – 394015. Property No.2:- All that piece and parcel o Flat No. 204, 2nd Floor, Building No. E1, Shiv Residency Umra Olpad Surat.-394015

The borrower's attention is invited to the provisions of sub section 8 of section 13, of the act, i respect of the time available, to redeem the secured asset. Public in general and borrowers i particular please take notice that if in case auction scheduled herein fails for any reason whatsoever then secured creditor may enforce security interest by way of sale through private treaty. In case of any clarification/requirement regarding assets under sale, bidder may Contact Mr. Rajender Dahiya (+91 8448264515), Mr. Kishore Arora (+91 7227953457), Mr. Brijesh Parmar(+91 9727739158) & Mr. Ravinder Godara (+91 9983999074). For detailed terms and conditions of the sale, please refer to the link https://www.kotak.com/en/bank-auctions.htm provided in kotak mahindra bank website i.e. www.kotak.com\_and/oron.https://bankauctions.in Place: Surat, Date: 04.09.2021 Authorized Officer: Kotak Mahindra Bank Limited

TATA CAPITAL HOUSING FINANCE LTD.

Registered Address: 11th Floor, Tower A, Peninsula Business Park, Ganpatrao Kadam Marg, Lower Parel, Mumbai - 400013. Branch Address: 4th Floor, Shanti Annexe, Opp B D Patel House, Nr Sardar Patel Statue, Naranpura, Ahmedabad.

NOTICE FOR SALE OF IMMOVABLE PROPERT

Reg. Off.: 101, Siddh Chambers, Taratiya Hanuman Street, Gurjar Faliya, Haripura, Surat-395003, Gujar (CIN: L45201GJ1993PLC114416) Tel: +91-7043999011 / 0261-2600331,

Email: info@panthinfinity.com, Website: www.panthinfinity.com

## NOTICE OF THE 28TH ANNUAL GENERAL MEETING OF THE COMPANY, BOOK CLOSURE & E-VOTING INFORMATION

NOTICE IS HEREBY GIVEN that 28th Annual General Meeting (AGM) of the Members of the PANTH INFINITY LIMITED will be held on Thursday, the 30th September, 2021 at 12:30 p.m. at Excluzo Business Centre, A-wing, 202-203, Union Heights, Rahulraj Mall Lane, Maharana Pratap Road, Vesu, Surat-395007, Gujarat to transact the business mentioned in the Notice of the Meeting sent along with the Explanatory Statement, Directors' Report, Auditor's Report and the Audited Financial Statements of the Company for the financial year ended 31st March, 2021.

The Annual Report for the financial year 2020-21 containing the Notice, Attendance Slip and Proxy Form has been sent on 6th September, 2021 to all the Members whose names appears on the Register of the Company as on 3rd September, 2021. Please note that there will be no dispatch of physical copies of notices to the members of the Company as per MCA circulars. These documents are also available on the website of the Company www.panthinfinity.com and on the website of National Securities Depository Limited (NSDL) http://www.evoting.nsdl.com. Notice is further given that pursuant to Section 108 of the Companies Act, 2013, Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing electronic voting facility from a place other than the venue of AGM ("remote e-voting") provided by

NSDL, on all the Resolutions set forth in the Notice. The details of remote e-voting are given below: (I) The remote e-voting shall commence on Monday, 27th September, 2021 (9:00 a.m.) and end on Wednesday, 29th September, 2021 (5:00 p.m.). The e-voting module shall be disabled for voting thereafter

The voting rights of Members shall be in proportion to their Shares of the Paid-up Share Capital of the Company as of the cut-off date i.e. 23th September, 2021.

i) Any person who acquires Equity Shares of the Company and becomes a Member after 6th September, 2020, i.e. date of dispatch of the Notice and holding shares as of the cut-off date i.e. 23rd September, 2021, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.inor info@panthinfinity.com.

# GOKUL REFOILS AND SOLVENT LIMITED

Regd. Office : State Highway No. 41, Nr. Sujanpur Patia, Sidhpur-384151 Gujarat Email:investor\_relations@gokulgroup.comWebsite:www.gokulgroup.com

- The 28th Annual General Meeting of the Company will be held on Thursday, the 30th September, 2021 at 11.00 A.M. at the Regd. Office of the Company at State Highway No. 41, Nr. Sujanpur Patia, Sidhpur-384151 to transact the business as set out in the Notice dated August 11, 2021, a copy of which has been posted / emailed to the Members of the Company at their registered address/email address together with the Annual Report for the year 2020-21.
- and remote e-voting instructions are also available on company's website www.gokulgroup.com and also available on the website of CDSL www.evotingindia.com
- Pursuant to provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 the Companies (Management and Administration) Rules; 2014, as amended, and Regulations 44 of the SEBI (LODR), 2015, the Company is pleased to provide the facility of casting votes using Electronic Voting System from a place other than the venue of the meeting ('remote e-voting') to it's shareholders for transacting the business contained in the Notice.
- The remote e-voting period commences on Sunday, September 26, 2021 @ 9.00 a.m. and ends on Wednesday, September 29, 2021 @ 5.00 p.m. No remote e-voting shall be allowed beyond the said date and time.
- as well as voting at the meeting.
- www.cdslindia.com

Corporate Identification Number : L15142GJ1992PLC018745

NOTICE is hereby given that :

- Members are hereby informed that the Notice of the 28th AGM, Annual Report
- Aperson, whose name appears in the register of Members/Beneficial owners as on the cutoff date i.e. September 23, 2021 only shall be entitled to avail the facility of remote e-voting
- Any person who becomes a member of the company after dispatch of the Notice of the meeting and holding shares as on the cut-off date i.e. September 23, 2021, may cast their votes by following the instructions and process of remote e-voting as provided in the Notice of the AGM uploaded at our website www.gokulgroup.com and CDSL website

PANTH INFINITY LIMITED

iv) Once a vote is cast by a Member, he/she shall not be allowed to change it subsequently v) The Members who cast their vote by remote e-voting may also attend the AGM but shall not be entitled to cast their vote again

In case of any queries pertaining to e-voting, members may refer to the Frequently Asked Questions (FAQs) for members and e-voting user manual for members available at the Downloads section of http://www.evoting.nsdl.com/ or contact Ms. Pallavi Mhatre, Assistant Manager NSDL, 4th floor, 'A' Wing, Trade World, Kamala Mills Compound, Lower Parel, Mumbai-400013; at e-mail:pallavi@nsdl.co.inTelephone No.: 022-24994545& Toll Free No.: 1800-222-990. Notice is further given that pursuant to provisions of Section 91 of the Companies Act, 2013 read with applicable rules and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday, 24th September, 2021 to Thursday, 30th September, 2021 (both days inclusive).

By Orders of the Board of Directors For PANTH INFINITY LIMITED JINAY KORADIYA (DIN: 03362217) Date : 05-09-2021 Place : Sovet. Chairman & Managing Director

- The members who are entitled to vote but have not exercised their right to vote through remote e-voting may vote at the Annual General Meeting through Ballot Paper for all business specified in the Notice dated August 11, 2021.
- The members who have cast their vote by remote e-voting may attend the meeting but shall not be entitled to cast their vote again.
- All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai-400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call on 022-23058542/43.
- . The entry at the meeting venue will be regulated by Attendance Slip, which has been sent along with the Annual report to the members. Members are requested to submit duly filled in Attendance Slip at the registration counter to attend the AGM.

By order of Board of Directors For, Gokul Refoils and Solvent Limited Abhinav Mathur **Company Secretary** 

only through voting by electronic means. The remote e-voting shall commence on Monday, the 27" September, 2021 at 9.00 a.m. (IST) and end on Wednesday, the 29° September, 2021 at 5.00 p.m. (IST). The remote e-voting module shall be disabled by CDSL for

- voting after 5.00 p.m. (IST) on Wednesday, the 29" September, 2021. The cut-off date for determining eligibility to vote through remote e voting or through the e-voting system during the AGM is Friday, the 26" March, 2021. Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail of the facility of remote e- voting, participating in the AGM through VC/OAVM facility and e-voting during the AGM.
- Members who have cast their vote by remote e-voting prior to the AGM may participate in the AGM through VC/OAVM facility but shall not be entitled to cast their vote again through e-voting system during the AGM.
- Members participating in the AGM and who had not cast their vote by remote e-voting shall be entitled to cast their vote through e-voting system during the AGM.
- Members holding shares in dematerialized mode and have not registered their e-mail addresses are requested to register their email address with respective depository participant and members holding shares in physical form are requested to update their email address with Corporation at sec-cell-gsfc@gujarat.gov.in or with RTA at mcsstaahmd@gmail.com to receive copies of the Annual Report and other communications.


For details relating to remote e-voting, please refer to the Notice of the AGM. In case of any queries relating to e-voting, please refer to the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com or write an email to helpdesk evoting@cdslindia.com or contact at 022-23058542. In case of any grievances connected with the facility for e-voting, please contact Mr. Rakesh Dalvi, Manager, CDSL, A Wing, 25" Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, NM Joshi Marg, Lower Parel (East), Mumbai 400 013. Email : helpdesk.evoting@cdslindia.com

### Book Closure:

D

Notice is also given pursuant to Regulation 12 of the GSFC General Regulations that the Register of Members and Share Transfer Books of the Corporation shall remain closed from 28.09.2021 to 30.09.2021 (both days inclusive) for the purpose of 61st AGM.

	By order of Board of Directors,
	for Gujarat State Financial Corporation,
Place : Gandhinagar	Raveendran Nair
Date : 03-09-2021	Secretary (Board)





Ph:079-27540647 Website: www.parshwanath.com Mail : Nd@parshwanath.co.in

Notice of 35"Annual General Meeting, E - Voting and Book- Closure Notice is hereby given that:

- The 35" Annual General Meeting (AGM) of the members of Parshwanath Corporation Limited ('the company') will be held on Tuesday 28th September, 2021 at 11:00 A.M (IST) Through video conferencing/othe Audio Visual Means (VC). In compliance with general circular numbers 20/2020, 14/2020, 17/2020 issued by Ministry of Corporate Affairs (MCA) and circular number SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 issued by the Securities and Exchange Board of India (SEBI) (hereinafter collectively referred to as 'circulars'), companies are allowed to hold AGMs through VC, without the physical presence of the members at a commor venue. Hence, the AGM of the company is being held through VC to transact the business as set forth in the notice of the AGM dated 28" September, 2021.
- In compliance with the circulars, electronic copies of the Notice of the AGM and Annual Report 2020-2021 have been sent to all the members whose email IDs are registered with the company/ Depository Participant(s). These documents are also available on the website of the company at www.parshwanath.com.Stock exchange website and on the website of National Securities Depository Limited (NSDL atwww.evoting.nsdi.com, The dispatch notice of the AGM through emails has been completed on 6"September, 2021.
- Members Holding shares either in Physical form or dematerialized form, as on the cut-off date (22" September, 2021), may cast their votes electronically on the business as set forth in the notice of AGM through the electronic voting system of NSDL ('remote e-voting'). Members are hereby informed that
- a. The Business as set fortht in the Notice of AGM may be transacted through remote e-voting or e-voting system at the AGM.
- The remote e-voting commence from Saturday , 25"September, 2021 10:00 a.m. and shall end onMonday, 27"September, 2021 at 05:00 p.m.
- c. The cut-off date for determining the eligibility to vote by remote e-voting or bye-voting system at the AGM shall be Wednesday 22" September 2021
- Remote e-voting module will be disabled after 5:00 p.m. IST d. 27"September, 2021
- Any person, who acquires shares of the company and becomes a member post-dispatch of the notice of the AGM and holds shares as on cut-off date i.e22<sup>40</sup> September, 2021may obtain the log in ID and password by sending a request at evoting@nsdl.co.inHowever, if

(Under Rule 9(1) of the Security Interest (Enforcement) Rules 2002) E-Auction Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the below Borrower and/ Co-Borrower, or their legal heirs/representatives (Borrowers) in particular that the below described immovable property mortgaged to Tata Capital Housing Finance Ltd. (TCHFL), the Physica Possession of which has been taken by the Authorised Officer of TCHFL, will be sold on 28th September 2021 on "As is where is" & "As is what is" and "Whatever there is" basis for recovery of outstanding dues from below mentioned Borrower and Co-Borrowers. The Reserve Price and the Earnest Money Deposit is mentioned below. Notice is hereby given that, in the absence of any postponement/ discontinuance of the sale, the said secured asset / property shall be sold by E-Auction at 2 P.M. on the said 28th September 2021 at Branch address TATA CAPITAL HOUSING FINANCE LIMITED, 4th Floor, Shanti Annexe, Opp B D Patel House, Nr Sardar Patel Statue Naranpura, Ahmedabad. The sealed envelope containing Demand Draft of EMD for participating in E-Auction shall be submitted to the Authorised Officer of the TCHFL on or before 27th September 2021 till 5 PM.

The sale of the Secured Asset/ Immovable Property will be on "as is where condition is" as per brief particulars described herein below ;

	Loan A/c.			Reserve Price Earnest Money	
No	No and Branch	Legal Heir(s) / Legal Representative/ Guarantor(s)	per Demand Notice		
1, 9911287	Mr. Mohmmadsajid Gulammayudin Shaikh		Rs. 940000/-		
	122-12202-1	(Borrower), Mrs. Ruksana Mohmmadsajid Shaikh (Co-borrower)	14.06.2019	Rs. 94000/-	
	scription o	Snakn (Co-corrower) if the Immovable Property: Immovable Proper trandi. Taluka Karian Det Vededara Artm About			

tesidency, Karamdi, Taluka Karjan Dst Vadodara Adm About Plot Area 86.673 Sq. MIrs. An Construction There Upon and Proportionate Share in Land for Common Road Adm 50.074 Sq Mtrs. And Proportionate Share in Common Plot Area Adm 15.367 Sq. Mtrs. Situated on the Plo No. A-1 To A-6. Plot No. C-1 To C-7, Plot No. C-27 To C-31, Plot No. D-32 To D-36 And Plot No. A 12 And A-13, Plot No. B-14 And B-15, Plot No. B-25 And B-26 And Plot No. A-27 To A-30 Adm Plo Area 2395,735 Sq. Mtrs. And Common Plot Area Adm 424,734 Sq. Mtrs. And Common Road Area Adm 1384.061 Sq. Mtrs. Total Adm 4204.53 Sq. Mtrs. All Situated On Land Bearing Block No. 690 (Old R S No. 408/1) In the Village Moje Karamdi, Taluka Karjan Dist Vadodara. Bounded as follows: East by: 7.50 Mt. Society Road, West by: Plot No. C-3 & C-4, North by: Plot No. A-12, South by: Plot No. B-14

2. 9369795 Mrs. Simran Sateesh Kharade (Borrower). Rs 20,73,748/- Rs. 1290000/-Mr. Sateesh Satyavan Kharade (Co-borrower) 31.08.2019 Rs. 129000/-

Description of the Immovable Property: All that the residential private bungalow no. 99/ admeasuring 492 sq. yds. i.e. 411 sq. mts. plot area including undivided proportionate share o common plot and common Road together with construction standing thereon admeasuring 105 sq. yds. i.e. 88 sq. mts. in a scheme known as "AAGAM 9" standing on the piece or parcel of land bearing Revenue Survey no. 13 (Old Amalgamated Survey No. 85/ paiki 1) (Amalgamated Survey No. 85 /2/ paiki 1, 85/paiki 1 & 87) admeasuring 82859 sq. mts. of Mouje Jagdishan Taluka Dasada in the registration District Surendranagar and Sub Dist: of Dasada Gujarat. Bounded as follows - East by : Bungalow no. 99 U, West by: Garden, North by: Bungalow no. 99 S, South by: Road

9337286 & Mrs. Laila A Lavij (Borrower), Mr. Alnoor Lavij, Rs. 41,00,317/- Rs. 2000000/ 9346097 (Co-borrower), Mr. Rahim Lavji (Co-borrower) 17.06.2016 Rs. 2,00,000

Description of the Immovable Property: A-21/102, Amelina Residency, Pratapgunj, Vadodara - 390002, C.s. No.251, 252, 253, 254, 256/a Paiki Plot No. A-21 At Village: Pratapgunj. Vadodara: 390002. On East By : Ots, On West By : Earth Apartments, On North By: Flat No.101 On South By: Akshar Apartments. "Note: A Civil Suit bearing no. RCS434/2020 filed by a third party is pending before Hon'ble Additional Civil Judge, Vadodara. There is no stay/ injunction order passed by Hon'ble Court against TCHFL

At the Auction, the public generally is invited to submit their bid(s) personally. The Borrower(s)/Co-Borrower (s) are hereby given last chance to pay the total dues with further interest within 15 days from the date of publication of this notice, failing which the Immovable Property will be sold as per schedule. The E auction will be stopped if, amount due as aforesaid with interest and costs (including the cost of the sale) are tendered to the Authorised Officer or proof is given to his satisfaction that the amount of such secured debt, interest and costs has been paid before the date of the auction. No officer or other person, having any duty to perform in connection with this sale shall, however, directly or indirectly bid for, acquire or attempt to acquire any interest in the Immovable Property sold. The sale shall be subject to the conditions prescribed in the Security Interest (Enforcement) Rules, 2002 and to the following further conditions: The E-auction will take place through portal https://DisposalHub.com on 28th Sept. 2021 between 2.00 PM to 3.00 PM with limited extension of 10 minutes each.

Terms and Condition: 1. The particulars specified in the Schedule herein below have been stated to the best of the information of the undersioned, but the undersioned shall not be answerable for any error, misstatement or omission in this proclamation. In the event of any dispute arising as to the amount bid, or as to the bidder, the Immovable Property shall at once again be put up to auction subject to the discretion of the Authorised Officer. 2. The Immovable Property shall not be sold below the Reserve Price. 3. Bid increment Amount will be: Rs.10,000/ (Rupees Ten Thousand Only) 4. All the Bids submitted for the purchase of the property shall be accompanied by Earnest Money as mentioned above by way of a Demand Draft favoring the 'TATA CAPITAL HOUSING FINANCE LTD." Payable at Branch address. The Demand Drafts will be returned to the unsuccessful bidders after auction. For payment of EMD through NEFT/RTGS/IMPS, kindly contact Authorised Officer. 5. The highest bidder shall be declared as successful bidder provided always that he/she is legally qualified to bid and provided further that the bid amount is not less than the reserve price. It shall be in the discretion of the Authorised Officer to decline acceptance of the highest bid when the price offered appears so clearly inadequate as to make it inadvisable to do so. 6. For reasons recorded, it shall be in the discretion of the Authorised Officer to adjourn/discontinue the sale. 7. Inspection of the Immovable Property can be done on 21st September 2021 between 11 AM to 5.00 PM. 8. The person declared as a successful bidder shall, immediately after such declaration, deposit twentyfive per cent of the amount of purchase money/bid which would include EMD amount to the Authorised Officer within 24Hrs and in default of such deposit, the property shall forthwith be put to fresh auction/Sale by private treaty. 9. In case the initial deposit is made as above, the balance amount of the purchase money payable shall be paid by the purchaser to the Authorised Officer on or before the 15th day from the date of confirmation of the sale of the property, exclusive of such day, or if the 15th day be a Sunday or other holiday, then on the first office day after the 15th day. 10. In the event of default of any payment within the period mentioned above, the property shall be put to fresh auction/Sale by private treaty. The deposit including EMD shall stand forfeited by TATA CAPITAL HOUSING FINANCE LTD and the defaulting purchaser shall lose all claims to the property. 11. Details of any encumbrances, known to the TATA CAPITAL HOUSING FINANCE LTD, to which the property is liable: Nil. Claims, if any, which have been put forward to the property and any other known particulars bearing on its nature and value: NIL. The Intending Bidder is advised to make there own independent inquiries regarding encumbrances on the property including statutory liabilities arears of property tax, electricity etc. 12. For any other details or for procedure online training on e-auction the prospective bidders may contact the Service Provider, M/s NexXen Solutions Private Limited, Address: #203, 2nd Floor, Shree Shyam Palace, Sector: 4&5 Crossing, Railway Road, Gurugram - 122 006 through its Mobile No. +91 97100 29933, +91 98100 29926, Tel. No. +91 124 4 233 933, E-mail ID: CSD@disposalhub.com or Arijit Bhatt, Email id Arijit bhatt@tatacapital.com Authorised Officer Mobile No 9029073280. Please send your query on WhatsApp Number - 9029073280 13. TDS of 1% will be applicable and payable by the highest bidder over the highest declared bid amount. The payment needs to be deposited by highest bidder in the PAN of the owner/ borrower(s) and the copy of the challan shall be submitted to our company 14. Please refer to the below link provided in secured creditor's website https://bit.ly/3h90PVD for the above details. Please Note - TCHFL has not engaged any broken/agent apart from the mentioned auctioning partner for sale/auction of this property. Interested parties should only contact the undersigned or the Authorised officer for all queries and enquiry in this matter.

# DEMAND NOTICE (IN PURSUANCE WITH SECTION 13 (2) OF THE SARFAESI ACT. 2002)

DCB BANK LIMITED has sanctioned Loans facility to the following borrowers to purchase residential premises &/or business purpose by creating equitable mortgage in favour of DCB BANK LIMITED. The repayment of the loan is irregular and the account is finally classified as Non Performing Asset in accordance with directions and guidelines of Reserve Bank of India.

Date : 06.09.2021

Place : Ahmedabad


DCB BANK has therefore invoked its rights under Section 13 (2) of the SARFAESI ACT, 2002 and called upon the borrowers to repay the total outstanding due mentioned therein, within 60 days from the date of the said Demand Notice.

The borrower is hereby also called upon again publicly to pay the said total dues plus the charges & interest accrued till date within 60 days from the date of this notice failing which DCB BANK shall resort to all or any of the legal rights to TAKE POSSESSION of the said premise and dispose it and adjust the proceeds against the overdue amount.

The borrower is also restrained from alienating or creating third party interest on the ownership of the property.

SR. NO	LOAN ACCOUNT NO.	BORROWER, CO-BORROWER, GUARANTORS & LEGAL HEIRS NAME	ADDRESS OF THE MORTGAGED PROPERTY	DEMAND NOTICE DATE	DEMAND NOTICE AMOUNT
1	DRBLCGR00405897 & DRBLCGR00426782 & 03642500000383	<ol> <li>Suresh Jashnamal Thakrani (deceased) Through His Legal Heir Vinaben Sureshbhai Thakrani</li> <li>Devanandbhai Jashnamal Thakrani</li> <li>Jitendrabhai Jashnamal Thakrani</li> <li>Janakiben Jashnamal Thakrani</li> <li>Bhavana Jashnamal Thakrani</li> <li>Rangeela Electronics And Video Library</li> </ol>	Plot No. 144/3+4, (Muni Tenament No. 0217-05-1116-0001-P & 0217-05- 1121-0001-P) In The Harijan Sindhi Co. Op. Ho. Society, Mukhi Mayaram Gali Nr. Municipal Office Thakkarnagar Ahmedabad -380001	21-June-21	Rs. 5858710.34/- as on 15, June, 2021
2	DRHLCGR00503465	1. Baburam Chotelal Nishant 2. Shila Devi Baboo Ram	G-202, Second Floor, Vedika Residency, Nr. Akruti Township, Narol, Ahmedabad - 382405	10-May-21	Rs. 1174639.48/- as on 06, May, 2021
3	DRMHCGR00423353	1. Jaysingh Bhabhutsingh Bhadoriya 2. Sonal Jayshingh Bhadoriya	LIG-1-C-1005, Gujrat Housing Board, Nr. Vivekanand Nagar, Hathijan, Ahmedabad 380050.	10-May-21	Rs. 734357.77/- as on 06, May, 2021
4	DRBLCGR00421464	1. Saheejad Isubhai Sindhi 2. Shakinaben Saheejadbhai Sindhi	1675, Chheepawad Nr Swaminarayan Mandir B/H Gandhi Chowk Kheda Ta Kheda Dist Ahmedabad - 387345	21-June-21	Rs. 1397375.85/- as on 18, June, 2021
5	DBLARAN00445030	1. Salimuddin Kamrauddin Malek 2. Jenulabeddin Salimoddin Malek 3. Nasimbibi Salimoddin Malek	Plot No. D/167, Al Madina Nagar, Nr. Tavakkal Soc. Panch Vad Vsana Village, Tal-Borsad, Dist. Anand, Borsad 388540.	26-Apr-21	Rs. 605141/- as on 26, April, 2021
6	DRMHSID00450553	<ol> <li>Sardarkhan Sikndarkhan Khokhar</li> <li>Soelkhan Sidarkhan Khokhar</li> <li>Mahemudaben Siddarkhan Khokhar</li> </ol>	Plot No. 3, Sipaivas, Kohkhar Vas, At Post : Vadhna, Taluka: Sidhpur, District : Patan - 384151	06-Aug-21	Rs. 1127646.95/- as on 03, August, 2021
7	HHOMSID00042515	1. Dipak Maheshchandra Jain 2. Dipika Dipak Jain	Flat No. 13, 3rd Floor, Silver Flat, Opp Doctor House, Nr. Shreyas Society, Nr. Vijay Nagar Society, Nr. Dayaram Society, Nr. Jall Road, Tal & Dist Mehsana - 384002	06-Aug-21	Rs. 701699.28/- as on 03, August, 2021
8	10052600000213	1. Chetna Sudhir Pandya 2. Sudhir Kanubhai Pandya 3. Manish Kanubhai Pandya	C. S. No. 4, Ground Floor, Sai Leela Building, Nr. Bank Of Baroda, Bhatwada Wadi, Vibhag-A, Mauje Kasba, Wadi, Vadodara - 390017	12-July-21	Rs. 1527407.46/- as on 06, July, 2021
9	DRMHSUR00444369	1. Iqbalbhai Abbasbhai Mansuri 2. Rabiya Iqbal Mansuri 3. Harun Abbasbhai Mansuri	Flat No: 206, 2nd Floor, Asmal Complex, Under Sapna Nagar, B/S. Sapana Cinema Nr. Amboli Char Rasta, Amboli Road, Amboli, Tal. Kamrej, Dist. Surat - 394185	19-Apr-21	Rs. 1391345.7/- as on 19, April, 2021
10	HHOMSUR00043825	1. Sureshbhai Mukundbhai Matholiya 2. Prabhaben Sureshbhai Matholiya	Flat No. I/307, Hari Krushna Residency, Nr. Railway Fatak, Umra, Tal. Olpad, Dist. Surat - 394540	28-Apr-21	Rs. 1079379/- as on 27,April,2021
11	HHOMSUR00053685	1. Devidas Dhanraj Patil 2. Yogesh Devidas Patil 3. Surekhaben D Patil	Plot No. 62 Aradhana Lake Town-4, B/H. Sahiba Mill, Opp. Jolwa Gram Panchayat, Jolwa, Palsana, Surat -394327	28-Apr-21	Rs. 1029788.78/- as on 27, April, 2021
12	DAHLKAD00416335	1. Sunil Ramdev Vasava 2. Kailashben Sunil Vasava	Flat No. 303 Nilkanth Residency Soni Park Housing Socety 2 Kadodara Bardoli Road Surat - 394327	30-July-21	Rs. 643209.71/- as on 30, July, 2021
13	DRHLSUR00474031	1. Shivaji Shridhar Mande 2. Shital Shivaji Mande	Flat No. 301, 3rd Floor, "Shree Balaji Arcade Bansi Park Soc, Near, Sahiba Mill, Bagumara Palsana Surat - 394305	30-July-21	Rs. 958571.81/- as on 30, July, 2021
14	DRMHVAP00439631	1. Santosh Shankar Patil 2. Yogini Santosh Patil	Flat 206 & 207 Maitri Appartment, Second Floor, Chharwada, Vapi - 396191	30-Apr-21	Rs. 1196041.09/- as on 29, April, 2021
15	04752600000134	1. Jainul Abddin Wakil Ahmad 2. Jawed Wakil Ahmad Anshari	304 K. G. N. Plaza, Opp. Bramdev Mandir Ganesh, Ngr. Dungra, Vapi Road, Vapi - 396193	07-June-21	Rs. 770556.78/- as on 05, June, 2021
16	DRMHVAP00435675	1. Dadarao Sakhraji Waghmare 2. Kusum Dadarao Waghmare 3. Sumedh Dadarao Waghmare 4. Sandhya Sumedh Waghmare 5. Mangesh Dadarao Waghmare	Flat No. 403, Shree Krishna Residency, Fourth Floor, Vallabh Nagar, Rata, Vapi, Vapi - 396191, Gujarat, India	30-Apr-21	Rs. 551345.08/- as on 29, April, 2021
17	DRHLVAP00467376	1. Shamsheer Ahmad 2. Zeba Afzal	Flat No. B-403 Poddar Urban Life Style Daheli Bhilad Ta Umbergaon District Valsad-396155	21-June-21	Rs. 1130329.52/- as or 18,June,2021
					For DCB Bank Limited
Date:07-	09-2021 hmadabad				Sd/- Authorized Officer





financialexp.epapr.in



a person is already registered with NSDL for e-voting then the existing used ID and password can be used for casting their vote Member may note that: a) The remote e-voting module shall be disable by NSDL beyond 5:00 p.m. IST on 27"September 2021and once the votes on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility for voting will also be made available during the AGM, and those members present in the AGM through facility, who have not cast their vote on the resolution through remote e- voting and otherwise not barred from doing so, shall be eligible to vote through the voting system at the AGM. c) the members who have cast their votes by remote e voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their votes again, and d) only persons whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall be entitled to avail the facility of remote voting at the AGM.

- The manner of voting remotely for members holding shares in · **q**. Dematerialized mode, physical mode and for members who have not registered the email address is provided in the notice of the AGM The details will also be made available on the website of the company. Members are requested to visit www.parshwanath.com to obtain such details.
- Members have not registered the email addresses are requested to register the email addresses with respective depository participant(s) and members holding shares in physical mode are requested to update the email addresses with company's Registrar and share transfer agent, Link Intime India Private Limited, at ahmedabad@linkintime.co.info receive copies of the annual report 2020-2021 along with the notice of the 35" AGM, instructions for remote evoting and instructions for participation in the AGM through VC. In case of queries relating to remote e-voting, members may refer to the frequently asked questions (FAQ's) for members and e-voting user manual for members at the downloads section NSDL

website for call the toll free number: 1800 22, 2990 or contact 9909973206.

Pursuant to Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Rules, 2015, the Registrar of Members and share transfer book of company will remain closed from Thursday 23" September, 2021 to Tuesday 28" September, 2021 (Both Days Inclusive) for the purpose of Annual General Meeting of the company.

For, Parshwanath Corporation Limited Riddhi R. Patel Joint-Managing Director & CFO

DIN: 00047238




Date: 06/09/2021

Place: Ahmeriabad

Place: Ahmedabad Date: 07.09.2021 Sd/- Authorised Officer, Tata Capital Housing Finance Ltd.





સુરત <b>ર</b>	સિટી	મંગળવાર તા.હ સપ્ટેમ્બર ૨૦૨૧	ාශසය ාාල්පත
સુરતમાં નવા કેસ સામે સારા થવાનો દર	મજૂરીદરમાં વધારાની માંગ સ્વીકારી લેવાલ		માર્ગદર્શન આપવા શરૂ
ઘટ્યો:નવા ત્રણ સામે બે દર્દીઓ ડિસ્ચાર્જ	<b>રાધારમણ માકેટના મજરોની હંડતાળ પ્</b> સુરત, તા.૬ વધીરો સ્વીકાર્યો છે, તેથી હડેત શનિવારથી જ સારોલીની આંશિક રીતે ખોલવામાં આવી	📱 કરાયલાાબઝનશકાઉન્સ	ોલિંગનીકાલેપ્રથમબેઠક
<b>સુરત, તા.૬</b> થઇ જતા રજા આપવામાં આવી હતી. તેમને રજા આપવામાં આવી હતી. તેમને રજા આપવામાં આવી હતી. જયારે શહેર જિલ્લામાં કોરોનાનાં સંક્રમણ અત્યાર સુધીમાં સુરત શહેર જિલ્લામાં કોરોનામાં સિવીલ હોસ્પિટલમાં ર દર્દીઓ કાબુમાં આવી ગયું છે ત્યારે કેસની સંખ્યા મળી મૃત્યુઆંક ૨૧૧૫ ઉપર પહોંચ્યો છે. સારવાર હેઠળ છે. જેમાં ૧ બાયપેપ અને <u>પણ ઘટી ગઇ છે. વિતેલા ત્રણ-ચાર આજે એક પણ મોત નોંધાયં નથી.</u> ૧ ઓકસીજન ઉપર છે. જયારે સ્મીમેર	ુ ઉચકનાર કામદારોની પાર્સલ ઉચકવાની કરવાનો પત્ર આપ્યો છે માત્ર તે મજુરીમાં વધારો	ારા મનું હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બિઝનેસ કાઉન્સેલિંગ સેન્ટર શરૂ મનું કરવામાં આવ્યું છે, જેની પ્રથમ બેઠક તા. 8 સપ્ટેમ્બરે સાંજે 4 ામાં વાગોપાગ્યાન્ગ ગોલર ગોલ તેગર્દની ગોગોભને સાંજે 4	માર્ગદર્શન આપવા માટે ચેમ્બરના અગ્રણી અને નિષ્ણાંત સંજીવ બિશ્નોઈ ઉપસ્થિત રહેશે.
મૃત્યુઆંક ૨૧૧૫ ઉપર સ્થિર, સારવાર હેઠળ હોસ્પટલમાં ૧ દર્દી સારવાર લઇ રહ્યા છે. રહેલા ૬૦માંથી બે દર્દીઓની હાલત ગંભીર સુરતની સ્થિતિ		ાના હજુ હેબ્દુ બિલ્ડિંગ ખાતે મળશે. મહિને બે વાર કાઉન્સેલિંગ તા કોલવ ોમાં સેમિનાર આયોજન કરવાનું ચેમ્બર દ્વારા નક્કી કરાયું છે. નથી 8મી સપ્ટેમ્બરે સેમિનારમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો આગળા ગ	इसइवा शाणा, घर लं १-८३, इसइवा, यथ, छ. तापा, गुपशत. झेन नं:०२४२५-२४१२४८. E-mail: kalsur@bankofbaroda.com ऊलभ लोटीस (स्थावर मिलडन्त भाटे) ये सर्व डरनारनी देंह जोड़ करोडा ना अधिइत अधिहारी द्धारा सिंडबुरिटाएंप्रेशन कल्ट्रइशन ओड़ हाई नाल्सीयल ओबेट्स अन्ड ओन्ड्रोसीन्ट ओड़ सिंडबुरीटी
મહિનાથી એકાદ બે કેસ સુરત સિટી અને અત્યાર સુધીમાં સુરત શહેર અને અગાઉના પોઝિટિવ ૧૪૩૬૧૩ જિલ્લામાં નોંધાઇ રહ્યા છે. સુરત શહેરમાં જિલ્લામાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા સોમવાર સવારથી સાંજ સુધીમાં ૩ કેસ ૧૪૩૬૧૬ થઇ છે. જેની સામે સારવાર	યુનિયનના અગ્રણીઓ <b>ાપઝપામા પછા જ્યાપ</b> તેઓના માટે હડત વચ્ચે સોમવારે ચાલુ રહેશે એટલે સાંજે યોજાયેલી બેઠકમાં હડતાળને તેમના પાર્સલ ઉચકવામાં આવશે ન	માલ નવા ઉદ્યાંગ સાહાસકાને માગદશન આપશે. રિટેઇલ <b>ઇન્ટરેસ્ટર</b> ો કે વેપારના અપગ્રેડેશન અને સમસ્યાઓ અંગે સલાહ હીં. આપવા અનિલ જેતવાણી, કોપીરાઈટ, પેટર્ન, ટ્રેડમાર્ક, <b>શ</b> .૩૩,૫૩	અંદ્રર, ૧૦૦૨ અને સીક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ટ્રોસંમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ની કલમ ૧૩ નિયમ ૩ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ તા.૨૫/૦૬/૨૦૨૧ ના રોજ કેરજદાર કુ. કાશ પટેલ ને ડૉમાન્ડ નોટીસ પાઠવી હતી. ઘદર નોટીસમાં દર્શાવેલી સ્ક્રમ ૩,૨૦૫.૮૯ (રૂપિયા તેત્રીય લાખ ત્રેપન હજાર બસો પાંચ અને નેવ્યાંસી પૈસા પુરા) જે 1/૨૦૨૧ શી લાગુ વ્યાજ સહિતની બાકી ઉપરાંત તેના ઉપર કરાર દર, વત્તા કિંમતો,
	સુરત જિલ્લા ટેક્સટાઇલ માર્કેટિંગ યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનના પ્રમુખ પ્રવક્તા શાન ખાન, સીતાર	પોર્ટ પરેશ લાઠીયા, કેપિટલ માર્કેટ અને શેરને લગતી <b>ચાજીવે ઝ</b> શ્રા, કોઇપણ સમસ્યા, ફિઝીકલ શેરમાંથી ડિબેટ કરાવવું હોય, શા, વારસાની સારસાની મેટર હોય, પાર્ટલી પેઈડ અપ કે રામ	ાને ખર્ચા સહિતંની રકમ સદરહુ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસમાં પરત પ્શાવ્યું હતું. સદરહુ રકમ પરત સુકવવામાં નિષ્ફળ જતા કરજદાર અને બ્રહેર જનતા ને આ સાથે ાપવામાં આવે છે કે નીચે સહી કરનારે સીકસુરીટી ઇન્ટરેસ્ટ (એન્ટોસીનન્ટ) રૂલ્સ, શેકેશન ૧૩ ના સબ–સેક્સન (૪) ના નિયમ ૮ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ
રાજપપીળા નગરપાલિકા દ્વારા નીરોની વિગતે કામો માટે ઓનલાઇન/ઓફલાઇન ભાવો મંગાવવામાં આવે છે. રસ અને લાચકાત ધરાવતા અરજદારો/ઇસમોએ ભાવો ભરવાના રહેશે. અનું. કામનું નામ ટેન્ડર અંદાજિત ટેન્ડર ભરવાનો નં. / ગ્રાન્થ ફી/ઇ. રક્મ/ટેન્ડર સમય	<sup>.</sup> ખાને જણાવ્યું હતું કે માર્કેટના 70 દિપક તિવારી, રાહુલ પાંડે સહિત	ત્યા, ટ્રોન્સફરની સમસ્યા અંગે માર્ગદર્શન મોટે શેરબજારના <b>લાયેલ છે.</b> એક્સપર્ટ કેતન દલાલ અને અયુબ યાકુબઅલી, કોઇપણ <b>ચઢરડુ ભલ</b> પકારની લોન તથા ગબગી 1 અંગેની ગમગ્યાઓ જેમ કે	ો જણાવેલી મિલકતનો સાંકેતિક કબણે તારીખ ૦૧/૦૯/૨૦૨૧ના દિને સંભાળી ોને કરજદાર અને જાહેર જનતાને આથી જાહેર ચેતવણી આપવામાં આવે છે કે તેમણે લકત બાબતમાં કોઈ વ્યવહાર કરવો નહી અને કોઈપણ વ્યવહાર બેંક ઓફ બરોડા, શાખા માટે રૂ1.33,43,204.૮૯ (રૂપિયા તેત્રીય લાખ ત્રેપન હજાર બિસો પાંચ અને આ આરોબે વ્યવસ્થાય ત્રાર છે.
श्रेम.डी. ३.     आछ.डी.       १     टे.इन्टा इग्रिया विरताव     ७००       ५०१ जी जेनना घटनी     /१२०००       ५१४ १०००     ५२४ १४४४       २०     २१,७७,४४४       २०     २१,७७,४४४       २०     २१,७७,४४४       २०     २१,७७,४४४       २०     २४,७७,४४४       २०     २४,७७,४४४       २०     २४,७७,४४४       २०     २४,७४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       ४४,४४४     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४       २०     ४४,४४४४       २०     ४४,४४४४       ४४,४४४४४     ४४,४४४	<b>ું આપતાં ડિંડોલીના કિશોરનો આપઘા</b> હોવાથી આયુષ ઘરે જ હતો. ત્યારે થઈ પણ માતાએ બાઇકની ચાવી અ	લોન માટે હાલમાં કઇ યોજના છે, લોન અંગે જરૂરી પેપર તૈયાર કરવા, CC/OD વગેરે પ્રશ્નો માટે કાઉન્સેલર તરીકે હરિવદન રાશા અને કુરજી પીપલીયા, "સ્ટાર્ટ અઠી કર	ોચા પુરા)જે તા.૨૫/૦૫/૨૦૨૧ થી લાગુ વ્યાજ ચહિતની બાકી ઉપરાંત તેના ઉપર વત્તા કિંમતો, ચાછુંસ અને ખર્ચા સહિતની રકમની વસુલાતને પાત્ર રહેશે. જદારનું ધ્યાન આફુષ્ટ કરવામાં આવે છે, કે જણાવેલ સમય મર્ચાદામાં સેકશન ૧૩ના ન (૮) હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતોને બાકો લેણા ભરપાઇ કરી પાછી મેળવી રશાવર મિલકત્તનું વર્ણન શાગ અને હિસ્સો ધરાવતી સ્થાવર મિલકત સ્થિત જેનો રે.સ. નં. ૯૮/પૈકી,
ભાગે સંરક્ષણ દિવાલ બાગે સંરક્ષણ દિવાલ બનાવવાનું કામ કાઉનલોડ કરીને ડિંડોલી વિસ્તારમાં આવેલ રાજદીપ સબમીટ કરી શકાશે. સોસાયટીમાં રહેતા બીજકિશોર સિંગ	. આયુષે રવિવારે સાંજના સમયે પંખા ન હતી. જેથી અંતિમ પગલું ભરી ૯ . સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ હતું.સિંગ પરિવારે પોતાનો એકનો ઃ . આત્મહત્યા કરી લીધી હતી. પુત્ર ગુમાવતા પરિવારમાં ગમર્ગ	તીધું આઈડિયા વેલિડેશન કરવા માટે, કો-ફાઉન્ડર શોધવા એક માટે, મેન્ટર મેળવવા માટે, ગવર્નમેન્ટ સ્કીમ્સ જાણવા <b>પટેલ લગ્ન</b> Iની માટે, ઇન્વેસ્ટર સાથે મુલાકાત કરાવવા માટે અને કોઈક <b>પટેલ</b> ''	. ડપી, વોર્ડ નં. પ, મિલ્કત નં. ૩૯૦/૧, ભગૃતિ સેસાયટી પાસે, અંધારવાડી રા, તાઃ વ્યારા, જી તાપી, સુલ વિસ્તાર ૪૮૧.૯૪ ચો.મીટર્સ પ્લોટ નં. ૧૪૬, છે માલિકી શ્રીમતી સ્મિતાલેન પ્રકાશભાઈ પટેલ અને સુ.પાચીલેન પ્રકાશભાઈ મીનદાર) ની છે. (સ્થળ મુજબ).જેની ચતુઃદિશા – પૂર્વી અન્ય જમીન સર્વે નં. બિચે ૧૨૨૨ને હિન્સે ગ્રેસ્ટ્ર જમીન સર્વે નં. ૮૮૫
આર.પી.એ.ડી. મારફ્ત તેમને સંતાનમાં એક પુત્ર અને એક મોકલી આપવાનું રહેશે. ટુજર ખોલવાની પુત્રી છે. જે પૈકી ૧૭ વર્ષિય પુત્ર આયુષ	. આયુષને રવિવારે રજાના દિવસે સાંજે પોલીસે તપાસ હાથ ધરી છે. ચાર વાગ્યાના અરસામાં ગલતેશ્વર . મહાદેવના મંદિરે જવું હતું. જે માટે	અપ સાથે મુલાકાત કરવા માટે સીએ મયંક દેસાઈ, અને ગાડી અં. ૯૮૫ી. આપ સાથે મુલાકાત કરવા માટે સીએ મયંક દેસાઈ, અને ગાડી ખું દે આ હેર ચેતવણી ઃ:-	
તા.૨૨-૦૯-૨૦૨૧. ધોરશ-7ના અભ્યાસ કર્યા બાદ પોતે (શહુલદેવ ઢોડિયા) (કુલદીપસિંહ ગોહિલ) ઘરે જ હતો. અને હાલ આયુષ ઓટો મુખ્ય અધિકારી પ્રમુખ ગેરેજમાં કામ કરી રહ્યો હતો. જો	. હતી. પણ સાંજનો સમય થઈ ગયો હોય જેથી માતાએ બાઈકની ચાવી આપી. હિંગ બને પુત્રો નામ સ્વ	ન રા-હાઉસ, ઉમરા ગામ, આલપાડ, સુરતના આથી જાહર ર ચેતવણી આપી જણાવીએ છીએ કે હમો નીચે સહી કરનારના પુકેશભાઇ ભુપતભાઇ ગોંડલીયા તથા પ્રકાશભાઇ ભુપતભાઇ પ્લોટ ટ્વાર આપણી સ્પોપ્ડ બાયો નથા પોનાં ગ્વાર્ત્સની પ્લોટ ટ્વાર આપણી સ્પોપ્ડ બાયો નથા પોનાં ગ્વાર્ત્સની	ટ, સીટી સબ ડિસ્ટ્રીકટ શહેર સુરતના <b>મોજે પાલણપોર</b> ના રેવન્યુ સર્વે 3 <b>૮</b> થી નોંધાયેલી બીનખેતીની જમીન જેનો ટી. પી. સ્કીમ નં. ૮ . ૧૦, ફા. પ્લોટ નં. ૮ છે જે જમીન પૈકી પુર્વ તરફનો હિસ્સો કે જ સબ મોળખાય છે જેનું ક્ષેત્રફળ સુમારે ૪૬૭૪ સમ યો.મી. છે તે જમીન ઉપર
પંચ ઈન્ફીનીટી લીમીટેડ (CIN: L45201GJ1993PLC114416) રજી. ઓફ.: ૧૦૧, સીધ્ધ ચેમ્બર્સ, તરતીચા હનુમાન સ્ટ્રીટ, ગુર્જર ફળીચા, હરીપુરા, ચુરત-૩૯૫૦૦૩, ગુજરાત. (૧) ગુલામ ઇબાહીમ પટેલ, રહે. રહાડ, તા. વાગર	जोटिस ::: ગોટિસ આપો જણાવવાનું કે, અમારા અસીલશ્રીઓ નામે ગોડા, આ, ભરચ (૨) ઉત્માન ગલામ પટેલ, રહે, રહાડ,	છે. અમોએ અમારા આ બંને પુગો સાથેના તમામ પ્રકારના આ શિવાહમસાગ હારો તોડી નાંખેલ છે. જેથી હવેથી મુકેશભાઇ ભુપતભાઇ શિભાઇ ભુપતભાઇ ગેંડલીયા સાથેના વ્યવ્હારો અંગેની કોઇપણ ગ હમો નીગે સહી કરનારની રહેશે નહી તેમજ મદેશભાઇ આહીર તથા (3) છ	<b>ર કો.ઓ.હા.સો.લી."</b> દ્વારા આયોજીત <b>"સાંઇતીર્થ રેસીડન્સી"</b> ના <b>ડીંગ સી/૧ ના પાંચમાં માળે</b> આવેલ <b>ફલેટ નં. સી/૧–૫૦૧</b> વાળી ાકો (૧) યોગેશભાઇ ઇશ્વરભાઇ આહીર, (૨) જીજ્ઞેશભાઇ ઈશ્વરભાઇ બુધીયાભાઇ નાનકાભાઇ આહીરના સંયુંકત નામે ચાલી આવેલી.
<b>ઇઝ</b> બાલ પટેલ, રહે. રહાડ, તા. વાગરા, જુ. ભરૂચ ત કંપનીની ૨૮મી વાર્યોક સાધારણ સભા, દિસાબી ચોપડા બંધ કરવા તથા ઇ-વોટીંગ માહિતી અંગેની નોટીસ આથી નોટીસ આપવામાં આવે છે કે પંચ ઇન્ટ્રીનોટી લિમોટેકના સભ્યોની વાર્યીક સાધારણ સભા (એજીએમ) ગડવાર તા. ઉભી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ બપોરે ૧૨.૩૦ કલાક એ ક્લ્લડો બિઝનેશ સેન્ટર, એ–વિંગ, ૨૦૨૦	અસીલશ્રીઓએ આ અગાઉ શરતચુક તથા અભાગતામાં 1 અસીલો સ્વીકારે છે તથા હવે પછી આવા વિડીચો કે આપીએ છીએ. જે આ બહેર નોટીશથી જાહેર જનતાને કોઇ વ્યક્તિ,ઇસમ	કરવા-કરાવવા નહી. જો કોઇએ તેવા વ્યવ્હારો કરેલા હોય કે जાનકાભાઈ આહીરે તે અંગેની અમારી કોઇપક્ષ જવાબદારી રહેશે નહી. તેમજ જો ા કે સંસ્થા મુકેશભાઇ ભુપતભાઇ ગોંડલીયા તથા પ્રકાશભાઇ ज. ૨૧૬, શેર ક્રમાંક વ	સકતના માલીકો પૈકી જીજ્ઞેશભાઇ ઇશ્વરભાઇ આહીર તથા બુધીયાભાઇ રીલીઝ્ડ દસ્તાવેજ નં. ૧૪૩૫૩, તા. ૨૨/૦૭/૨૦૨૧ કરી યોગેશભાઇ આપેલ છે. આ ફલેટ અંગે સોસાયટી દ્વારા ઇસ્યુ કરેલ શેર સર્ટીફીકેટ ૧૦૭૬ થી ૧૦૮૦, તા. ૧૮/૦૨/૨૦૧૦ કેજે મુળ માલિકોના નામે ચાલી
તા. ૩જી સપ્ટેમ્બર સુધીમાં જે સબ્યોના નામ કંપનીના રજીસ્ટર માં અધીકૃત રીતે નોંધાયેલા છે તેવા તમામ સબ્યોને હાજરીની રસીદ અને પ્રોલી કોર્મ સાથેની નોટીસ સાથે નાણાકીય વર્ષ ૨૦૨૦–૨૦૨૧ નો વાર્ષીક રીપોર્ટ રહેા. રહેા. તા. વાગારા, જી. ભરૂચ.	અમારા અસીલશ્રીઓ વતી સરફરાજ આર. ભદ્વી (એડવોકેટ) એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ મો.નં. ૯૧૦૬૫ દરાબ્રર સ	ર કૃત્યો કરશે તો તે વ્યક્તિ વિરૂધ્ધ કાયદેસર રાહે સખ્ત પગલા બી જાહેર જનતાએ ગંભીર નોંધ લેવી. (તા. ૦૭/૦૯/૨૦૨૧) શેર સર્ટીફીકેટ કાઢી પ્રકારનો વાંધો હોય લ	ીંફીકેટ ગેરવલ્લે થયેલ છે. જે ઘણી શોધખોળ કરવાં છતાં મળી આવેલ ોસાયટી પાસેથી ડુપ્લીકેટ શેરની માંગણી કરેલ છે. જે સદરહું ડુપ્લીકેટ ો આપવાની કાર્યવાહી કરનાર છે. તો આ બાબતે કોઈને કોઈપણ તો તેમણે આ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન–૭ હમારા નીચે જણાવેલ બરૂ જાણ કરવી. મુદ્દત વિત્યે આવેલ વાંધા સ્વીકારવામાં આવશે નહી
દસ્તાવેજોની આરીજીનલ કોપી મોકલવામાં આવશે નહી, જેની કૃપા કરી નોંધ લેશો. આ દસ્તાવેજો કંપનીની વેબસાઈટ www.panthinfinity.com અને નેશનલ સ્લિયુરીટીઝ ડિપોઝીટરી લિમીટેડ (એનએસડીએલ) ની વેબસાઈટ http://www.evoting.nsdl.com. પર પણ ઉપલબ્ધ છે. વધુમાં જણાવવામાં આવે છે કે કંપની એક્ટ ૨૦૧૩ ખંડ ૧૦૮, કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમીનીસ્ટ્રેશન) રૂલ્સ ૨૦૧૪ માં ૧૯ ૨૦. સેબી (લીઝીટી) ઓલ્લીગ અને પરિસ્લોઝર રીકલાયટમેન્ટ) રૂઆલેશન્સ ૨૦૧૫ રૂચલલોગ અ	ઓફિસ ઃ- એસ/૦૩, આરોગ્ય યોકડી, વાગરા (ભુપતભાઇ રામભાઇ ગોડલીયા) નોટીસ :::: ટાઈટલ ક્લીચરન	રરર, રોયલ આકંડ, સરથાણા, સુરત. સ અંગેની જાહેર નોટીસ ::- શ્રી શિવોહંમ	ગાવવાની કાર્યવાહી કરી દેવામાં આવશે. (તા. ૦૭/૦૯/૨૦૨૧) સાગર કો. ઓ. હાઉસીંગ સોસાયટી લી. ઓફિસ :- મોજે : પાલણપોર, સુરત.
ઇ-ચાટોગ") અનઅસઇઅલ તરફથા પુરા પાડવામાં આવશ. અનુ નાટોસમાં જણાવવામાં આવલ તમામ ઠરાવા પર મતદાન થઈ શકશે. રીમોટ ઈ-ચોટીંગની માહીતી નીચે મુજબ છે. (૧) રીમોટ ઈ-ચોટીંગ સોમવાર રગ્મી સપ્ટેખ્બર, ૨૦૨૧ (સવારે ૯.૦૦ વાગ્યે) શરૂ થશે અને બુધવાર સ્૯મી સપ્ટેખ્બર, ૨૦૨૧ (સાંજે પ.૦૦ વાગ્યે) પુરુ થશે. ત્યારબાદ ઈ-ચોર્ટીંગ મોડયુલ પર મતદાન થઈ શકશે નહીં. (૨) સબ્યોને મૃતદાનના અધિકારનું પ્રમાણ રગ્મી સપ્ટેખ્બર ૨૦૨૧ ના રોજ કંપનીની પેઈડ-અપ શેર કેપીટલના આકાર <b>શી દફ્તરે ટેનામેન્ટ નંબર ર</b> ાનુટ્રમે સ	i વદારાના વિસ્તાર, ભેસ્તાન ના રેવન્થુ સર્વ ર નગર ના નામથી ઓળખાય છે તેમાં પાડવામાં મિલકત કે જેનો સુરત મહાનગર પાલીકાના રલ્ભી-૦૯-૧૩૯૧-૦-૦૦૧, રલ્ભી-૦૯-૧૩૯૧-	૧૨૬ પેકી, સિટી સર્વે વોર્ડ : અઠવાના નોંધ નં. ૨૦૫૦ ોંધવામાં આવેલ મિલક્ત ઉપર બાંધવામાં આવેલ જોલી તેના અપર ગાઉન્ડ ક્લોર ઉપર આવેલ બ્લોક / દુકાન આ હાલના સાલિક ભાવનાવેન ગ્રશોકભાઇ પટેલરકે	<mark>ઇટલ ઈન્વેસ્ટીગેશન રીપોર્ટ અન્વચેની જાહેર નોટિસ</mark> ગતા વળગતાઓને જણાવવાનું કે, મોજે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વન્યુ રેકર્ડ દફતરે ખેતી સિવાયના <b>બ્લોક/સર્વે નં.૨૪/પેકી ર</b> થી નોંધાયેલી
આધાર આપવામાં આવશ. (૩) કોઈપણ વ્યક્તિ કટી સપ્ટેમ્બર ૨૦૨૧ પછી સભ્ય બને અને ઈક્વીટીશેર ધરાવતી હોય અથવા ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧ની છેલ્લી તારીખ સુધીમાં નોટીસ અને શેર ધરાવતા હોય તેમજો ઈ–વોટીંગ હક્ક મેળવવા માટે લોગઈન આઈડી અને પાસવર્ડ ની સાથે ઈ–વોટીંગ એટ એનએલડીલ.કો.ઈન અને evoting@nsdl.co.in OR info@panthinfinity.com. પર વિનંતી મોકલવાની રહેશે.	-૦૯-૧૪૧૧-૦-૦૦૧,૨૯૦મી-૦૯-૧૪૧૧-૦-૦૦૨, સ.ચો.મી. સોગ્રફળ વાળી વથા વેને લાગવા ની જમીનના માલિકી હકકો સહિતની મિલકત આવંગ્ર, કબળ, ભોગવટા, વહીવટ, વ્યવસ્થા આવંગ્ર, કબળ, ભોગવટા, વહીવટ, વ્યવસ્થા આવંગ્ર, કરેલ છે. તેથી સદસ્દુ મિલક્ત ઉપર કોઈ પ	: ૧૩७૩૨, તા. ૨૮-૧૦-૨૦૧૦ થી વેચાણ આપેલ તે જમીન જેમાં હાલમાં "ર તેની અસલ રજીસ્ટ્રેશન રસીદ ગૂમ ચાને ગેરવલ્લે થયા મારી કનેથી ટાઈટલ ક્લીચરન્સ સર્ટીફીકેટની માંગણી ાણ વ્યક્તિ, બેંક, સંસ્થા કે અન્ય કોઈને પણ કોઈ પણ પ૦') જેનું કુલ લેગ્ફળ	<b>સાંઈ વંદના"</b> ના નામે ઓળખાતી ૨હેણાંક ઉપયોગી મકાન બાંધવા માટેનું ાવેલ છે. જે માંહે પાડવામાં આવેલ પ્લોટો પૈકી પ્લોટનં. ૪૩-એ ઉત્તરદિશા તથા પ્લોટનં.૪૪-બી દક્ષિણ દિશા તરફની (૧૧' x ૫૦') મળી કુલ (૨૧' x ૧ <b>૧૦૫૦.૦૦ ચો. કુટ થાય છે. એટલે ચો.મી. ૯હ.૫૪</b> થાય છે. જે જમીનમાં
(૫) રીમોટ ઈ—વોટીંગથી મતદાન કરનાર સબ્ય એજીએમમાં હાજરી આપી શકશે, પરંતુ તે કરીથી મતદાન કરી શકશે નહીં. આપવા માંગે છે. જેશી જો કોઈ અન્ય વ્યકતિ	તે, સંસ્થા, કે શખ્સ નો સદરહુ મિલકતમાં કોઈ તારીખથી દિન-૫ માં નીચે જણાવેલ સરન	તામે પુરાવા સહિત લેખિતમાં મને જાણ કરવી. મુદ્દત આપવામાં આવેલી જીલ	fl તા.30.9૨.૨૦૦૮ ના રોજ મળેલ સામાન્ય સભાના <b>6રાવ નં.૪૩(૧૪)</b> થી લા વિકાસ અધિકારીશ્રીએ મંજૂર કરેલ નક્શા મુજબનું બાંધકામ કરવાની વેલ બાંધકામની પરવાનગી મુજબ બાંધવામાં આવેલ રહેણાંક ઉપયોગી

ninowpantninning, colin, રર સ્વાય તેમ તો મહાવ પાંચ રહશ. (૪) સાવ્ય તે કે તેણી દારા એક વખતા મતદાન થયા પછી બીજી વખત મતદાન કરી શકશે નહી. (૫) રી મોટ ઇ-વોટીંગથી મતદાન કરનાર સાવ્ય એજીએમમાં હાજરી આપી શકશે, પરંતુ તે કરીથી મતદાન કરી શકશે નહીં. સલ્યની ઈ-વોટીંગ માટે કોઈપણ પૂછપરછ હોય તો તેમણે ફીક્વ-ટલી આરકડ કવેશ્વન (એકએકયુએસ) પર મોકલવા. સવ્યો અને ઈ-વોટીંગ નો ઉપયોગ કરનારાઓ મોટે મેન્યુઅલ મતદાન પણ ડાઉનલોડીંગ સે ક્સશન http://www.evoting.nsdl.com સંપર્ક સાધી શકે છે અથવા ક્રમારી પલ્લવી મહાતે, આસીસ્ટન્ટ મેનેજર, અનઅસીએલ, ચોથ માળે, અ-વીંગ, ટ્રેડવર્લડ, કમલા મીલ્સ કંમાઉન્ડ, લોઅર પરલ મુંબઈ-૪૦૦૦ગ, ઈમેઈલ : pallavi@nsdl.co.in અને ટેલીકોન નં. ૦૨૨-૨૪૯૯૪૫૪૫ અને ટોલ કી નંબર ૧૮૦૦ -૨૨૨-૯૯૦ નો સંપર્ક કરી શકે છે. વધમાં જણાવવાનું કે કંપનીઝ એક્ટ, ૨૦૧૭ના ખંડ ૯૧ ની સાથે લાગુ પડતા રૂલ્સ અને સેબી (લીસ્ટીંગ ઓલ્લીગેશન્સ એન્ડ ક્રીક્લોઝર રીક્વાયરમેન્ટ્સ) ના રેગ્યલેશન ૨૦૧૫ ના રૂલ ૪૨ મુજબ કંપનીની શેર ટ્રાત્સકર બુક ૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૧ થી ૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૧૬૧ (બંને દિવસ સહિત) બંધ રહશે. આંક ઓન્ડ ક્રીક્લાંગ દાર છે. વારીખ: ૦૬-૦૯-૨૦૨૧ સ્થળ : સુરત DIN: 03362317	તમના <b>માલાકોએ</b> સદરહુ મિલકત પાતાના સ્વત્રબ, કબબ, ભાગવટા, વહાવટ, વ્યવસ્થા તથા સપુંર્ણ માલિકીની હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ કરી કબબ રસીદ કરી આપવા માંગે છે. જેથી બે કોઈ અન્ય વ્યકતિ, સંસ્થા, કે શખ્સ નો સદરહુ મિલકતમાં કોઈ પણ પ્રકારનો હકક, હીત, હિસ્સો કબબે ભોગવટો, વહીવટ, વ્યવસ્થા, સહમાલિકી હકક, કે દાવા દુવીના પ્રકરણો, ભરણપોષણ ના અધિકારો, ટાંચ, જરી ના હુકમો, કે ગીરવે ના હકકો હોય અને સદરહુ મિલકત બાબતે કોઈ તરતકરાર કે વાંધા વિરોધ હોય તો તેવી વ્યકતિ,સંસ્થા, કે શખ્સે આ નોટીસ પ્રસિદ્ધ થયાથી <b>દિન ૭ (સાત)</b> માં પુરાવા સહીત જાણ કરવી અને સદરહ મિલકત બાબતે કોઈ તરતકરાર કે વાંધા વિરોધ હોય તો તેવી વ્યકતિ,સંસ્થા, કે શખ્સે આ નોટીસ પ્રસિદ્ધ થયાથી <b>દિન ૭ (સાત)</b> માં પુરાવા સહીત જાણ કરવી અને મુદ્દત વીત્થે બે કોઈ તરતકરાર કે વાંધા રજુ કરવામાં ન આવશે તો કોઈને કોઈ પણ બાત ની તરતકરાર કે વાંધા વિરોધ નથી તેમ માની અમારા અસીલ મિલકત અંગેના તમામ વ્યઢવારો પૂર્ણ કરશે અને ત્યાર બાદ કોઈના કોઈ પણ બાતના વાંધા કે તરતકરાર ચાલશે નહી જેની સ્પષ્ટ નોંધ લેવી. અબ્દુલઅઝોઝ અબ્દુલકાદર શેખ આ નોટીસ અમારી સુચના મુજબ આપવામાં આવી છે.	કરેલ છે. તેથી સદરહુ મિલકત ઉપર કોઈ પણ વ્યક્તિ, બેંક, સંસ્થા કે અલ્ય કોઈનો પણ કોઈ પણ પ્રકારનો હક્ક, હિત, સબંધ, બોબે, ચાર્જ કે કબજો હોય તો તેલે આ નોટીસ પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૫ માં નીચે જણાવેલ સરનામે પુરાવા સહિત લેખિતમાં મને જાણ કરવી. મુદત વિત્યે કોઈના કશા પ્રકારના લક્ક, હિત, હિસ્સા, દર-દાવા, સંબંધ કે કબજા નથી તેમ ગણી સદરહુ મિલકત અંગે માંગ્યા મુજબનું ટાઈટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે અને તે બાદ કોઈની કોઈ પણ પ્રકારની તકરાર ચાલશે નહીં તેની નોંધ લેવી. મિલેષ રોન. જરરીવાલા (એડવોકેટ) ઠે. હલ, ગાંધી હાઉસ, નર્મદનગર, આદર્શ ભિવનની પાસે, સુરત ટેનીસ કલબની ગલીમાં, અઠવાલાઇન્સ, સુરત. મો.નં. ૯૮૨૫૧૩૩૯૧૪ જીલ્યન ક્રેટ્ટ બિ ધતાલ ક્રસ્ટ બિ બાલ ક્રસ્ટ ગ્રાહ્ય હિમ ચાર રસ્તા શાખા : ગ્રાઉન્ડ ફલોર, અંબિકા સ્ટીલ ફેબ્રીકેશનની પાસે, તેન એસ. ૮ ની પાસે, કિમ સ્ટેશન રોડ, સુરત, કિમ ચાર રસ્તા - ઉલ્૪૧૧૦, ગ્રુજરાત.	પo') જેનું કુલ ક્ષેત્રફળ ૧૦૫૦.૦૦ થી.કુટ થાય છે. એટલે ચી.મી. ૯૯.૫૪ થાય છે. જે જમીનમાં ગ્રામ પંચાયત બાબેનની તા.૩૦.૧૨.૨૦૦૮ ના રોજ મળેલ સામાવ્ય સભાના ઠરાય નાં.૪૩(૧૪) થી આપવામાં આવેલી જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ મંજૂર કરેલ નક્શા મુજબનું બાંધકામ કરવાની શરતે આપવામાં આવેલ બાંધકામની પરવાનગી મુજબ બાંધવામાં આવેલ રહેશાંક ઉપયોગી મકાન જેનું બાંધકામનું સુમારે ક્ષેત્રફળ આશરે ૮૨૨ થી.કુટ જેના ચો.મી. હદ્.૩૯ થાય છે. જે બાબતે ગ્રામ પંચાયતના રેકર્ડ દફતરે ઘર નાં.૧૧૩૨/૪૬થી નોંધાયેલ ચાલી આવેલ મિલકત. જેના માલિક શ્રીમતી સંજલકંવર અવતારસિંગ શેખાવત, રહે .:-૨૮ન સુંદરમ એપાર્ટમેન્ટ, નગીન દેશાઈની ચાલ,બારડોલી, તા.બારડોલી, જિ. સુરતનાઓની સ્વતંત્ર માલિકી, કબજા, ભોગવટા વહીવટ હેઠળ ચાલી આવેલ હોવાનું જણાવી હમારા અશેલને તેઓ વેચાણ કરવા માંગે છે સદરહુ મિલકત તેઓ દેવારા "ઇન્ડિયન ઓવરસીઝ બેંક",બારડોલી શાખામાં ઉપરોક્ત મિલકત ગીરો મુકી ધિરાણ મેળવવામાં આવેલ છે તે રિવાયની બે અન્થ કોઈ વ્યકિત રામક્ષ કોઈ પણ પ્રકારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ અન્ય કોઈ નાણાંકીય સંસ્થામાં ગીરો મુકવામાં આવેલ છેય અને અન્થ કોઈ બાહિત વ્યકિતનો ભાગ ભાગ,હક્ક-હિરસો.દર-દાવો અગર હોઈ જાટેલ માય છે અને અન્થ કોઈ બાહિત વ્યકિતનો ભાગ ભાગ,હક્ક-હિરસો.દર-દાવો અગર હોઈ શરદરહુ મિલકત અન્થ કોઈ બાહિત વ્યકિતનો ભાગ ભાગ,હક્ક-હિરસો.દર-દાવો અગર હોઈ શરદરહુ મિલકત રાધ્રીયકૃત બેક અગર સહકારી બેંક" સમક્ષ ગીરો મુકવામાં આવેલ હોય અથવા સદરહૂ મિલકત
પ્રેટર ગેન્ડપ્રેટર ગેન્ડપ્રતાર ગેન્ડપ્રતા ગેન્ડપ્રતાર ગેન્ડપ્રતાર ગેન્ડપ્રતાર ગેન્ડપ્રતાર ગેન્ડપ્રતાર ગેન્ડપ્રતાર ગેન્ડપ્રતાપ્રતાપ્રતા ગેન્ડપ્રતાપ્પ્પ્પ્પ્પ્પ્પ્રતપ્રતપ્રતપ્રતપ્રતપ્રતપ્રતપ્પ્પ્પ્પ્પ્પ્પ્પ્પ્પ્પ્પ્પ્ <th< td=""><td>केलता के दिवायाय विश्व के कि कि</td><td>પગેરાને ગોટીસ (બિયા - ૮(૧) આથી નીચે સહી કરનાર શુનિયન બેંક એફ ઈન્ડિયા ના અધિકૃત અધિકારીશીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ કાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, ૨૦૦૨ (૫૪ ઓફ ૨૦૦૨) તથા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ સહિત કલમ ૧૩(૧૨) અંતર્ગત મળેલ સત્તાની રૂએ તા. ૦૮.૦૪.૨૦૨૧ ના રોજ ડીમાન્ડ નોટીસ ઉધારકર્તા / જામીનદાર / ગિરવેદાર સુસુકુ વંબાલીમ કલાનીથા (ઉધારકર્તા), રેલાના સુસુકુ કલાનીથા (ઉધારકર્તા), આશીફભાઈ ઈબ્રાલીમ કલાનીથા (ઉધારકર્તા), રેલાના સુસુકુ કલાનીથા (ઉધારકર્તા), આશીફભાઈ ઈબ્રાલીમ લાખ અઠશાવીસ હજાર સીપેર અને સાત પૈસા પુશ) વત્તા વ્યાજ સાથે ૨૦ દિવસની અંદર બાકી રકમ સહિત ચુકવવા જણાવેલ. ઉધારકર્તા / જામીનદાર / ગિરવેદાર ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તા / જામીનદાર / ગિરવેદાર તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ રૂલ્સ ૨૦૦૨ની અધિનિયમની કલમ ૧૩ ની પેટા કલમ (૪) તથા ઉક્ત નિયમો હેઠળના નિયમ ૮ અંતર્ગત મળેલ સત્તાની રૂએ અધેહસ્તાશરકર્તાએ તા. ૦૨.૦૨.૨૦૨૧ ના રોજ નિમ્નલિપિત થિલકતનો સાકેતિક કલ્મ લાઈ થીપો છે. ઉધારકર્તા / જામીનદાર / ચિરવેદાર ને વિરોધ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિહ્કત અંગે કોઈપક્ષ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવથી આપવામાં આવે છે. સહરહુ મિહ્કત અંગે કેરેલો કોઈપક્ષ વ્યવહાર સુન્ચિક્ત હેલ ઓફ ઈન્ડિયા, ઉમ થાર સ્ટતા શામા ની રક્ષ ફા. ૨૦,૦૨,૦૨૦૨ ન રો જે કોઈપક્ષ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવથી આપવામાં આવે છે. સહરહુ મિહ્કત અંગે કેરેલો કોઈપક્ષ વ્યવહાર સુન્ચિક્ત સંક્ષ સ્ટાલ સેન્ડ સ્ટાલ સ્ટા શામા ની સ્ટમ્સ ફા. ૨૦,૦૨,૨૦૨૧ ના રોજ કોરેસ્ટ અને વ્યાજ સાથેનાબો જા સહિત રહેશે. "સરકેસી ક્ષયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે મુકરર ઉધારકર્તાઓ / જાધાનદારો/ચિરવેદારોને મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે." પ્યાવર ગિલ્ડન્ટુ વાઈન મોર્ગેજ કરેલ સ્થાવર સિહકત (માલીક : રેહાના યુગ્રુક કાલાનીયા અને યુગ્લફ ઈબ્રાહીમ કાલાનીયા), મિલકતનું વર્લન : પ્લોટ ન, પર, એરીયાનું ક્ષેત્રકળ ૮ ક.ગ પ સ્ક્રે.ગી, ઝીત રેસીડેન્સી ના નામની જાદીતી સોસાયટી, જમીનન વે વન્યુ બ્લોક ન. ૩૩/પેકી - ૧, મોજે ગામ -ભાટકોલ, તાલુકો - માંગરોળ, જીલ્લો - સુરત. અધિરન્ટ</td><td>સન્વચે સાટાખત, બાનાખત, સોદાચીક્રી, સંમતિપગ્રક, કબુલાતનામું/પાવર ઓફ એર્ટની બાંઠેઘરી ખતઝન્થ કોઈપણ ખાનગી વ્યક્તિ કે કોઈપણ સરકારી/ બિન સરકારી નાણાંકીય સંસ્થાને ગીરો કરી આપવામાં આવેલ હોય તો આ નોટિસ પ્રસિદ્ધ થયે દિન-હ માં લેખિત દસ્તાવેજી પુરાવા રજુ કરવા. બે મુદત વીત્યે કોઈના કોઈપણ ભાતના વાંધાએ નહી આવશે તો સદર મિલકતનુ ટાઈટલ ઈન્વેસ્ટોગેશન રીપોર્ટ આપવામાં આવશે.જેથો પાછળથી કોઈની કોઈપણ તરરાર ચાલશે નહી જેને ભહેર નોટિસ થકી બહેર બનતાએ નોંધ લેવી. તા. ૦૬/૦૯/૨૦૨૧ સુધીર શરદ સુ<b>() (અડવોકેટ અને નોટરી)</b> ઓફીસ: ૧૦૨ ગોવિંદ ભૂવન, સુળે કોમ્પલેસ, સરાજી વેભવ લાયબ્રેરી સામે, નવસારી કોન નં. <b>૦૨</b> રૂચ્છે સ્પલ્૪૪૩, મોબાઇલ નં. ૯૮૨૫૦૯૦૯૫૦ અફ્રીટર શરદ સુ<b>() (અડવોકેટ અને નોટરી)</b> ઓફીસ: ૧૦૨ ગોવિંદ ભૂવન, સુળે કોમ્પલેસ, સરાજી વેભવ લાયબ્રેરી સામે, નવસારી કોન નં. <b>૦૨</b> રૂચ્છે સ્પલ૪૪૩, મોબાઇલ નં. ૯૮૨૫૦૯૦૯૫૦ અફ્રીટર ગાય સ્વર્થ પોઈન્ટ સાખા : મર્મથ ધોર્પિંગ સેન્ટર, અંબિલા નિકેતન ગેઢની પાસે, પાસે પોઈન્ટ, સુરત - ૩૯૫૦૯૦૯૫૦ પરિવિષ્ટ - ૧૦ પઝેશન નીટીરી (લ્લમ - ૧૩(૪) (સ્વાપર વિસક્ત માટે) આથી નીચે સહી કરનાર કેનેશ બેંક ન અધિકૃત અધિકારીશીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્પનેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, ૨૦૦૨ (૫૪ ઓફ ૨૦૦૨) (ત્યાર બાદ એકટ તરીકે ઓળખાય છે) તથા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (બેન્ફોર્યનેન્ટ) નિયમે, ૨૦૦૨ના નિયમ ગ સડિત કલય ૧૩(૧૨) અંતર્ગત મળેલ સત્તાની રૂએ તા. ૧૨.૦૪.૨૦૨૧ ના રોજ ઉધારકર્તા બી નિવેશ નરેશ જરીવાલા (ઉધારકરતા) અને બીમતી હેમાલી નિલેશ જરીવાલા (સહ-ઉધારકતી), એકાઉલ્ટ તં. ૧૧૭૯૦૭૦૦૦૮૫૫ ને જરી કેડીને નોટીસમાં જયાવેલ શ. ૧.૧.૧૪.૮૧૯.૮ (શ. સત્તર લાખ શેદ હતાર આટલો છોઝાધીસ અને લક્ષ વીધા બિરાક્ય સહિત યુકવવા જશાવેલ. ઉધારકર્તા ઉપરોક્ત રક્ષ્ય યુકવવા માં કેયુરવાર થતાં આથી ઉધારકર્તા તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમની કલ્ય ૧૨ ની પેટા હવા બા બહેકત નિયમો હેઠળના નિયમ ૮ અને ૯ અંતર્ગત મળેલ સતાની રૂએ અધીલસતાશરકતાંએ મિલકતનો તા. ૦૪.૦૯.૨૦૨૧ ના રોજ બાડકતાને વિશેપ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહ્ય વિલક્ત એને કેરેલો કોઈપણ વ્યવહાર કેનેશ અપવામાં આવે છે કે અધિવ્યમની કલ્ય ૧૨ ની પેટા કલ્ય બે એ કેટલ તે એ કેરેલો કોઈપણ વ્યવહાર કેનેશ</td></th<>	केलता के दिवायाय विश्व के कि	પગેરાને ગોટીસ (બિયા - ૮(૧) આથી નીચે સહી કરનાર શુનિયન બેંક એફ ઈન્ડિયા ના અધિકૃત અધિકારીશીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ કાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, ૨૦૦૨ (૫૪ ઓફ ૨૦૦૨) તથા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ સહિત કલમ ૧૩(૧૨) અંતર્ગત મળેલ સત્તાની રૂએ તા. ૦૮.૦૪.૨૦૨૧ ના રોજ ડીમાન્ડ નોટીસ ઉધારકર્તા / જામીનદાર / ગિરવેદાર સુસુકુ વંબાલીમ કલાનીથા (ઉધારકર્તા), રેલાના સુસુકુ કલાનીથા (ઉધારકર્તા), આશીફભાઈ ઈબ્રાલીમ કલાનીથા (ઉધારકર્તા), રેલાના સુસુકુ કલાનીથા (ઉધારકર્તા), આશીફભાઈ ઈબ્રાલીમ લાખ અઠશાવીસ હજાર સીપેર અને સાત પૈસા પુશ) વત્તા વ્યાજ સાથે ૨૦ દિવસની અંદર બાકી રકમ સહિત ચુકવવા જણાવેલ. ઉધારકર્તા / જામીનદાર / ગિરવેદાર ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તા / જામીનદાર / ગિરવેદાર તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ રૂલ્સ ૨૦૦૨ની અધિનિયમની કલમ ૧૩ ની પેટા કલમ (૪) તથા ઉક્ત નિયમો હેઠળના નિયમ ૮ અંતર્ગત મળેલ સત્તાની રૂએ અધેહસ્તાશરકર્તાએ તા. ૦૨.૦૨.૨૦૨૧ ના રોજ નિમ્નલિપિત થિલકતનો સાકેતિક કલ્મ લાઈ થીપો છે. ઉધારકર્તા / જામીનદાર / ચિરવેદાર ને વિરોધ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિહ્કત અંગે કોઈપક્ષ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવથી આપવામાં આવે છે. સહરહુ મિહ્કત અંગે કેરેલો કોઈપક્ષ વ્યવહાર સુન્ચિક્ત હેલ ઓફ ઈન્ડિયા, ઉમ થાર સ્ટતા શામા ની રક્ષ ફા. ૨૦,૦૨,૦૨૦૨ ન રો જે કોઈપક્ષ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવથી આપવામાં આવે છે. સહરહુ મિહ્કત અંગે કેરેલો કોઈપક્ષ વ્યવહાર સુન્ચિક્ત સંક્ષ સ્ટાલ સેન્ડ સ્ટાલ સ્ટા શામા ની સ્ટમ્સ ફા. ૨૦,૦૨,૨૦૨૧ ના રોજ કોરેસ્ટ અને વ્યાજ સાથેનાબો જા સહિત રહેશે. "સરકેસી ક્ષયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે મુકરર ઉધારકર્તાઓ / જાધાનદારો/ચિરવેદારોને મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે." પ્યાવર ગિલ્ડન્ટુ વાઈન મોર્ગેજ કરેલ સ્થાવર સિહકત (માલીક : રેહાના યુગ્રુક કાલાનીયા અને યુગ્લફ ઈબ્રાહીમ કાલાનીયા), મિલકતનું વર્લન : પ્લોટ ન, પર, એરીયાનું ક્ષેત્રકળ ૮ ક.ગ પ સ્ક્રે.ગી, ઝીત રેસીડેન્સી ના નામની જાદીતી સોસાયટી, જમીનન વે વન્યુ બ્લોક ન. ૩૩/પેકી - ૧, મોજે ગામ -ભાટકોલ, તાલુકો - માંગરોળ, જીલ્લો - સુરત. અધિરન્ટ	સન્વચે સાટાખત, બાનાખત, સોદાચીક્રી, સંમતિપગ્રક, કબુલાતનામું/પાવર ઓફ એર્ટની બાંઠેઘરી ખતઝન્થ કોઈપણ ખાનગી વ્યક્તિ કે કોઈપણ સરકારી/ બિન સરકારી નાણાંકીય સંસ્થાને ગીરો કરી આપવામાં આવેલ હોય તો આ નોટિસ પ્રસિદ્ધ થયે દિન-હ માં લેખિત દસ્તાવેજી પુરાવા રજુ કરવા. બે મુદત વીત્યે કોઈના કોઈપણ ભાતના વાંધાએ નહી આવશે તો સદર મિલકતનુ ટાઈટલ ઈન્વેસ્ટોગેશન રીપોર્ટ આપવામાં આવશે.જેથો પાછળથી કોઈની કોઈપણ તરરાર ચાલશે નહી જેને ભહેર નોટિસ થકી બહેર બનતાએ નોંધ લેવી. તા. ૦૬/૦૯/૨૦૨૧ સુધીર શરદ સુ <b>() (અડવોકેટ અને નોટરી)</b> ઓફીસ: ૧૦૨ ગોવિંદ ભૂવન, સુળે કોમ્પલેસ, સરાજી વેભવ લાયબ્રેરી સામે, નવસારી કોન નં. <b>૦૨</b> રૂચ્છે સ્પલ્૪૪૩, મોબાઇલ નં. ૯૮૨૫૦૯૦૯૫૦ અફ્રીટર શરદ સુ <b>() (અડવોકેટ અને નોટરી)</b> ઓફીસ: ૧૦૨ ગોવિંદ ભૂવન, સુળે કોમ્પલેસ, સરાજી વેભવ લાયબ્રેરી સામે, નવસારી કોન નં. <b>૦૨</b> રૂચ્છે સ્પલ૪૪૩, મોબાઇલ નં. ૯૮૨૫૦૯૦૯૫૦ અફ્રીટર ગાય સ્વર્થ પોઈન્ટ સાખા : મર્મથ ધોર્પિંગ સેન્ટર, અંબિલા નિકેતન ગેઢની પાસે, પાસે પોઈન્ટ, સુરત - ૩૯૫૦૯૦૯૫૦ પરિવિષ્ટ - ૧૦ પઝેશન નીટીરી (લ્લમ - ૧૩(૪) (સ્વાપર વિસક્ત માટે) આથી નીચે સહી કરનાર કેનેશ બેંક ન અધિકૃત અધિકારીશીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્પનેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, ૨૦૦૨ (૫૪ ઓફ ૨૦૦૨) (ત્યાર બાદ એકટ તરીકે ઓળખાય છે) તથા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (બેન્ફોર્યનેન્ટ) નિયમે, ૨૦૦૨ના નિયમ ગ સડિત કલય ૧૩(૧૨) અંતર્ગત મળેલ સત્તાની રૂએ તા. ૧૨.૦૪.૨૦૨૧ ના રોજ ઉધારકર્તા બી નિવેશ નરેશ જરીવાલા (ઉધારકરતા) અને બીમતી હેમાલી નિલેશ જરીવાલા (સહ-ઉધારકતી), એકાઉલ્ટ તં. ૧૧૭૯૦૭૦૦૦૮૫૫ ને જરી કેડીને નોટીસમાં જયાવેલ શ. ૧.૧.૧૪.૮૧૯.૮ (શ. સત્તર લાખ શેદ હતાર આટલો છોઝાધીસ અને લક્ષ વીધા બિરાક્ય સહિત યુકવવા જશાવેલ. ઉધારકર્તા ઉપરોક્ત રક્ષ્ય યુકવવા માં કેયુરવાર થતાં આથી ઉધારકર્તા તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમની કલ્ય ૧૨ ની પેટા હવા બા બહેકત નિયમો હેઠળના નિયમ ૮ અને ૯ અંતર્ગત મળેલ સતાની રૂએ અધીલસતાશરકતાંએ મિલકતનો તા. ૦૪.૦૯.૨૦૨૧ ના રોજ બાડકતાને વિશેપ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહ્ય વિલક્ત એને કેરેલો કોઈપણ વ્યવહાર કેનેશ અપવામાં આવે છે કે અધિવ્યમની કલ્ય ૧૨ ની પેટા કલ્ય બે એ કેટલ તે એ કેરેલો કોઈપણ વ્યવહાર કેનેશ
જાહેર નોટીસ આર.આર.બોરડ, સબ ડિવીઝનલ બેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં વાદી/અરજદાર :- રાઠોડ પ્રકાશભાઇ નટવરભાઇ	જાહેર નોટીસ આર.આર.બોરડ, સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં વાદી/અરજદાર :- પ્રકાશભાષ્ઠ હરીવદનભાષ્ઠ ભક્ત રહે.:- દુ/શ્પદ્(, રામપુરા મેછન રોડ, સુરત. વિરહ્ય <u>અરજદારના વકીલશી: રોકેશ જે. સોલં</u> કી પ્રતિવાદી/સામાવાળા:- જન્મ મરણ રજીસ્ટ્રારશ્રી, સુરત મહાનગરપાલિકા, સુરત. મનિષ જી.પટેલ વિષશ: જન્મ/મરણની નોંધણે અધિનિચમનો કલ્ય '3(3) મુલ્બ લગ્ય/મરણની નોંધણી કરાવવા બાબત. આથી આ જાહેર નોટીસથી લાગતા-વળગતા તમામ ઇસમોને જણાવવામાં આવે છે કે, સદર અરજીમાં અરજદારશ્રી પ્રકાશભાષ હરીવદનભાષ્ઠ ભક્ત, રહે.:- દૂ/શ્પદ્(, રામપુરા મેઇન રોડ, સુરત ના પિતા હરીવદન મગનભાલ ભક્તનતું અવસ છે. અને તેઓના અવસાનની નોંધણી જે-તે વખતે કાયદાથી અજાણ હોઇ ભુલ અને શરતચૂકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંધણી કરાવવા અંગેની કોર્ટમાં અરજી દામબ કરેલ છે. તો સદર અવસાનની નોંધણી કરાવવા સામાવાળાને હુકમ કરવા સામે કોઇ પણ ઇસમને વાંધો કે તકરાર હોય તો આગેની કોર્ટમાં નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૩૦ માં વાંધો રહુ કરવો. જો વાંધો નહીં આવે તો વાંધો નથી, તેમ માની આગળની કાર્ચવાણે કરવામાં આવશે. જેની તમામ લાગતાં-વળગતાં ઇસમોએ નોંધ લેવી. આજ રોજ તા. ૦૧/૦૯/૨૦૨૧ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્ક કરીને આયો. હિલ્લો સાય ક્રેય્સર, સોટી પ્રગત, સુરત.	જાહેર નોટીસ આર.આર.બોરડ, સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં વાદી/અરજદાર :- અશ્વિનકુમાર છશ્વરભાઇ પટેલ	બેંક ની રકંચ રૂા. ૧૬,૨૨,૪૩૧.૦૮ અને રૂા. ૯૦,૬૮૨.૧૪ અનુક્રમે દુલ રહમ રૂા. ૧૭,૧૩,૧૧૩.૨૨ (રૂા. સતર લાખ તેર હજાર એક્સો તેર અને બાવીસ પૈસા પુરા) તા. ૩૧.૦૮.૨૦૨૧ ના સુધી અને વ્યાજ સાયેના બોજા સહિત રહેશે. "સરફેસી કાયદાની કલમ ૧ ૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે મુકરર ઉધારકર્તાઓને મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે." સ્થાયર મિલ્કતનું વર્જન શ્રી નિલેશ નરેશ જરીવાલા અને શ્રીમતી હેમાલી નિલેશ જરીવાલા ના નામની સ્થાવર મિલકતનો કલેટ નં. ૩૦૮ (ત્રીજો માળ), જેનું શ્રેત્રકળ ૬૬.૪૨.૩૪ સ્કે.મી., અવિભાજીત હકક સાથે બધી જ સુવિધાઓ સાથે, તુલશી શ્યામ એપાર્ટમેન્ટ ની જાજ્ઞીતી બિલ્ડીંગ, બધી જ સુવિધાઓ સાથે, જમીનનો આર. એસ. નં. ૨૪/૨/એ, બ્લોક નં. ૨૯ અને ૨૮, ટી.પી. નં. ૨૮, એક.પી. નં. ૭૨ અને ૭૩ પૈકી, પ્લોટ નં. એ/૧૯, એ/૨૫ અને એ/૨૯, જે સ્થિત ગામ - અલથાથ, જીલ્લો - સુરત, સબ જીલ્લો - સુરત સીટી. હતુ:શીમા :- ઉત્તરે : જોડેનો રાધેશ્યામ એપાર્ટમેન્ટ, દક્ષિકો : જોડેનો કોમન ખુલ્લો પ્લોટ, પૂર્વે : જોડેનો રોડ, પશ્ચિમે : જોડેનો રોડ. સ્લી/-, તારીખ : ૦૪.૦દ.૨૦૨૧, સ્થળ : સુરત
જાહેર નોટીસ આર.આર.બોરડ, સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં વાદી/અરજદાર : મોહંમદ વુસુક મોહંમદ તાહેર ચામડીથા નં. જ. મ. પ્ર/એસ.આર. નં. ૪૨૧-૨૦૨૧ રહે.:- ૧૮, નિશાંત સોસાયટો, અડાજઘ પાટીયા, સુરત. તા. ૨૧/૦૮/૨૦૨૧ વિરૂદ્ધ પ્રતિવાદી/સામાવાળા: જન્મ મરણ રજીસ્ટ્રારથી, સુરત મહાનગરપાલિકા, સુરત. <u>વિષધ : જન્મ/મરણની નોંધણી અધિનિયમની કલમ ૧૩(૩) મુજબ જન્મ/મરણની નોંધણી કરાવવા બાબત.</u> આથી આ જાહેર નોટીસથી લાગતા-વળગતા તમામ ઘસમોને જણાવવામાં આવે છે કે, સદર અરજીમાં આરજદારથી મોહંમદ ચુસુક મોહંમદ તાહેર ચામડીયા, રહે.:- ૧૮, નિશાંત સોસાયટી, અડાજઘ પાટીથા, સુરત ના માતા કાતમાબાઇ મોહંમદ તાહેર ચામડીયાનું અવસાન તા. ૨૫/૦૫/૧૯૯૦ ના રોજ ૧૮, નિશાંત સોસાયટી,અડાજણ પાટીયા, સુરત ખાતે થયેલ છે. અને તેઓના અવસાનની નોંધણી જે-તે વખતે ક્યારથી આજા હોઇ બુલ અને શરતથૂકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંધણી કરાવવા અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. તો સદર અવસાનની નોંધણી કરાવવા સામાવાળાને હુક્મ કરવા સામે કોઇ પણ ઇસમને વાંધો કે તકાર દશે વા એગેની કોર્ટમાં નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૩૦ માં વાંધો રજી કરતા વાંધો નહી આવે તો વાંધો નથી, તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતાં-વળગતાં ઇસમોએ નોંધ લેવી. આજ રોજ તા. ૨૧/૦૮/૨૦૨૧ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્સ કરીને આયો. હુક્કમથી સબ્દ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, અને નાયબ ક્લેક્ટર, સીટી પ્રાંત, સુરત.	<u>જાહેર નોટીસ</u> આર.આર.બોરડ, સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં વાદી/અરજદાર :- દિપક ઇશ્વરભાઇ વાઘેલા નં. જ. મ. પ્ર/એસ.આર. નં. ૪૪૧-૨૦૨૧ રહે.:- ૨૦૨, સંતોષનગર સોસાચટી, શ્રીકૃષ્ણા એપાર્ટમેન્ટ, તા. ૦૧/૦૯/૨૦૨૧ એલ.એચ.રોડ, સુરત. <u>ઉલ્</u> ર <u>અજ્યદારના વકલિક્રો: કૌષ્ઠિક એન. દ્વાત</u> પ્રતિવાદી/સામાવાળા:- જન્મ મરણ રજીસ્ટ્રારશ્રી, સુરત મહાનગરપાલિકા, સુરત. વિષય : જન્મ/મરણની નોંધણી અધિનિયમની કલમ ૧૩(૩) મુજબ જ્ય/મરણની નોંધણી કરાવવા બાલત. આથી આ જાહેર નોટીસથી લાગતા-વળગતા તમામ ઇસમોને જણાવવામાં આવે છે કે, સદર અરજીમાં અરજદારશ્રી દિપક ઇશ્વરભાઇ વાઘેલા, રહે:- ૨૦૨, સંતોષવનગર સોસાચટી, શ્રીકૃષ્ણા એપાર્ટમેન્ટ, એલ.એચ.રોડ, સુરત ના માતા કંચનનેન ઇશ્વરભાઇ થાઘેલાનું અવસાન તા. શ્ર્ય/૦૯/૨૦૦૨ ના રોજ ૩૧૫, હસ્તિનાપુર સોસાચટી,પુણાગામ, સુરત ખાતે થયેલ છે. અને તેઓના અવસાનની નોંધણી કરાવવા અગેની કોર્ટમાં અજાર દીષ્ઠ ભૂલ અને શરતથૂકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંધણી કરાવવા અગેની કોર્ટમાં અરછા દાખલ કરલ છે. તો સદર અવસાનની નોંધણી કરાવવા સામાવાળાને હુક્મ કરવા સામે કોઇ પણ ઇસમને વાંધો કે તકરાર હોય તો અગેની કોર્ટમાં નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૩૦ માં વાંધો રજુ કરવો. જો વાંધો નહી આવે તો વાંધ નથી, ની, મ માની આગળની કાર્ટવાહી દલ-૩૦ માં વાંધો રજુ કરવો. જો વાંધો નહી આવે તો વાંધ નથી, ની, મ માની આગળની કાર્ટવાય કરવામાં આવશે. જેની તમામ ભાગતાં-વળગતાં ઇસમોએ નોંધ લેવી. આજ રોજ તા. ૦૧/૦૯/૨૦૨૧ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આચો. (શ્રદ્ય)	જાહેર નોટીસ આર.આર.બોરડ, સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં વાદી/અરજદાર : મોહંમદ ઝીશાન ઇક્તેખારૂદ્ધન મોમ્બાસાવાલા નં. જ. મ. પ્ર/એસ.આર. નં. ૪૩૪-૨૦૨૧ રહે.:- ૧૧/૧૧૧૧-એ, બી.કે.પ્લોટ નં. દ, બાબુલ મક્કા એન્કલેવ, તા. ૦૧/૦૯/૨૦૨૧ મુગલીસરા મેઇન રોડ, આઇ.પી.મીશન વિદ્યાલયની ગલી, સુરત. વિરૂદધ પ્રતિવાદી/સામાવાળા: જન્મ મરઘ રજીસ્ટ્રારથી, સુરત મહાનગરપાલિકા, સુરત. વિષય: જન્મ/મરઘનીનોંધથી આદિનિયમનીકલમ ૧૩(૩) મુજબ જન્મ/મરઘનીનોંધથી કરાવવા બાબત. આથી આ જોટ નોટીસથી લાગતા-વળગતા તમામ ઇશમોને જેઘાવવામાં આવે છે કે, સદર અરજીમાં અરબદાશ્રી મોહંમદ ઝીશાન ઇટ્રનેખારૂદીન મોખવાશાયાલા, રહે.:- ૧૧/૧૧૧, એ.બી.કે.પ્લોટ નં., બાબુલ મક્કા એન્ડલેવ, મુગલીસરા મેઇન રોડ, આઇ.પી.મીશન વિદ્યાલયની ગલી, સુરત ના અરબદાર પોતે મુહમાદ ઝીશાન ઇફ્ટોબારૂદીન મોબસાવાલાનો જન્મ તા. ૧૫/બા/૧૯૮૬ ના રોજ ૧૧/૧૧૧, અ/.બી.કે. પ્લોટ નં.દ, બાબુલ મક્કા એન્ડલેવ, મુગલીસરા મેઇન ડોડ, આઇ.પી.મીશન વિદ્યાલયનો ગલી, સુરત ના અરબદાર પોતે મુહમાદ ઝીશાન ઇફ્ટોબારૂદીન મેબનારાલાલો જન્મ તા. ૧૫/બા/૧૯૮૬ ના રોજ ૧૧/૧૧૧, આતે થેશે છે. અને તેઓના જન્મની નોંધથી જે ને વખતે કાયદાથી અભાય હોઇ ભુલ અને શરતચૂકથી કરવવાનો રહી ગયેલી છે. તેની નોંધણી કરાવવા અગેની કોર્ટમાં અરજી દાબલ કરેલ છે. તો સદર જન્મનો નોંધથી કરાવવા સામાવાળાને હુકમ કરવા સામે કોઇ પણ ઇશ્વમને વાંધી કે તે કરાર હોય તો અત્રેની કોર્ટમ તે સિદ્ધ સિદ્ધ સરથેથી દિલ-૩૦ માં વાંધો રજુ કરવો. બે વાંધો નહી આવે. તે વાધો નથી, તેમ માની આગ્લો કારેવાલી કરવામાં આવશે. જેની તામા લાગતાં-વાળગતાં ઇસમોએ નોંઘ લેવી. આજ રોજ તા. ૦૧/૦૯/૨૦૨૧ ના રોજ મારી સહી તથા કોર્ટના કોર્ટના સાથે. જા સા બાદેવીઝાય સાથ, સ્વત સાથે જે લગ્ન સાથે લાવા સાથે તે સાથે.	જાહેર નોટીસ મહેરબાન સુરતના ૧૧ માં એડી. સિવીલ જડજ સાહેબની કોર્ટમાં અરજદાર : બળવંતભાઇ દુલ્લભભાઇ પટેલ કિમી.પરચુ.અરજી નંબર-૭૩/૨૦૨૦ રહે. મુ.પો. દામકા, બેંક ઓફ બરોડા પાસે, દરજી ફળિયું, તા. ચોર્ચાસી, જી.સુરત. વિરુદ્ધ વડીલશ્રી અજીત આર.પટેલ સામાવાળા : તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામપંચાયત દામકા, તા. ચોર્ચાસી, જી.સુરત. આથી જાહેર નોટીસ આપી જણાવવાનું કે, ઉપરોક્ત અરજદારના માતૃશ્રી પ્રેમીબેન દુલ્લભભાઇ ડાહ્રાભાઈ પટેલનું મરણ તા. ૧૪/૦૨/૨૦૧૦ ના રોજ મુ.પો. દામકા, તા. ચોર્ચાસી, જી. સુરત. આથી જાહેર નોટીસ આપી જણાવવાનું કે, ઉપરોક્ત અરજદારના માતૃશ્રી પ્રેમીબેન દુલ્લભભાઇ ડાહ્રાભાઈ પટેલનું મરણ તા. ૧૪/૦૨/૨૦૧૦ ના રોજ મુ.પો. દામકા, તા. ચોર્ચાસી, જી. સુરત મુકામે થયેલાની નોંઘ સરકારી દફતરે કરાવવાની અરજી અત્રેની કોર્ટમાં આપેલ છે. સદર અરજી સુનવણી તા. ૦૯/૦૯/૨૦૨૧ ના રોજ કલાક ૧૧.૦૦ વાગ્યે રાખવામાં આવેલ છે. જે કોઈ વ્યક્તિને સદર અરજી અંગે વાંઘો શેય, તો તેમો જાતે અગર તેમના વકીલશ્રી મારફતે અત્રેની કોર્ટમાં અયુક હાજર રહી પોતાના વાંઘા, તકારાર જુ કરવા. જે કોઈ વ્યક્તિ તરફથી વાંઘા, તકાર ઉઠાવવામાં નહીં આવે તો કોઈ વ્યક્તિને વાંઘો નથી, તેમ ગણી આગળની કાર્યવાઠી કરવામાં આવશે. જેના નૉલ લેવી. આજ રોજ ર મી માહે જુલાઈ સને ૨૦૨૧ ના રોજ મારી સહી તથા સિકકો કરી આપ્યા. મુકાબલ કરનાર તૈયાર કરનાર (એસ. બી. પટેલ) (એન. એમ. પટેલ) આસીસ્ટેટ આસીસ્ટન્ટ

Printed by Manojbhai Laljibhai Mistry at GUARDIAN PRESS B-17/2, Hojiwala Industrial Estate, Sachin-Palsana Road, Near Sachin, Surat on behalf of owners Manojbhai Laljibhai Mistry & Published by Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry Editor: Manojbhai Laljibhai Mistry.